

શ્વ. માનસંગળ બારડ રમારક ટ્રેસ્ટ - સંચાલિત

વર્ષ ૩૧ મુ.  
આંદોલન  
સ. ૨૦૪૭  
સન ૧૯૮૧  
અનુષ્ઠાનિ

તંત્રી-મંડળ :  
પ્રો. કે. કા. શાહેની  
ડૉ. ના. હે. ભાડી  
ડૉ. સૌ. ભારતીઘણેન  
શેખાલ

# મધ્યાસ

[ ધર્તિલાસ-પુરાતત્ત્વનું એક માત્ર ગુજરાતી માસિક ]

આદ તંત્રી : શ્વ. માનસંગળ બારડ

ઇન્દ્રાસેભા સમધંસસંક્ષયં તપર્યથસ્તુ અરુરજિનબાં ઇવ ।  
અદ્ભુતિષે કંઠાદે ધોરચક્ષસે દ્વેષો ધતમનબાયં ડિમીદિને ॥

(૫૦૨૬. ૭-૧૦૪-૨, અથવ. ૮-૪-૨)

[ હે ઇન્દ્ર અને સોમદેવ ! તમે ખ'ને, પાપકર્મભાં લિપન થયેલા પારીઓને ખરાખર  
દિક્ષારી. અનિન પર મૂકેલ હાંઠિની કેમ અન્યને દુઃખ આપનાર વ્યક્તિને તમે તપાવો.  
નાસ્તિક, માંસાહારી, કુર દિલ્લિવાણી અને સર્વભક્ષણ વ્યક્તિ પર તમે નિરંતર તમારો  
ઘોડીભાવ રાખો. ]

૫ ]

## હુંમણ અવસાન

માત્ર દસ દિવસના ગાળામાં ત્રણ મહાતુલાવ વિદ્ધાનોનાં અવસાન ગુજરાતી વિદ્યસમાજને ફરમે ધા  
આપી ગયાં છે ગુજરાતના અદેતનિષ્ઠ રંગભૂમિના પ્રાણીશ્રદ્ધ કવિ-સર્જન સેખા અને નાટકીયાએ અલિન-  
નિષ્ઠાત ભાઈ જસ્વાંત ડાઢ, ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ અને ઉચ્ચ ડેટિના વિવેચન (નીચાઈં  
ડેટે, પાલા-મુનીઠના ભૂતપૂર્વ) આચાર્ય શ્રી અમૃતલાલ યાજીંઠ અને છેલ્સે ગુજરાતી સાહિત્ય પરિષદના  
ભૂતપૂર્વ પ્રમુખ, અને યોવેરી અને ચંદ્રકોના વિનેતા, શિક્ષણભગતના તો ઉચ્ચ ડેટિના શિક્ષણકાર કવિ-  
સર્જન સેખા વાયોદ્ધ આચાર્ય શ્રીધાનાઈ દેવાઈ રસેહરસિંહ, આ ત્રણ અગ્રિમ ડેટિના ગુજરાતી સારસ્વતોને  
આપણે ગુજરાત્યા છે આ ધા વર્ષો સુધી ન રૂપાય એવા છે. પરસ્કૃપાળુ પ્રભુ એમના આત્માઓને પોતાના  
અરજોભાં શાશ્વત શાંતિ આપે એવી પ્રાર્થના.

— તંત્રી

With Best Compliments From

**VXL INDIA (LTD.)  
(SAURASHTRA CHEMICALS)**  
PORBANDER  
MANUFACTURERS OF BASIC CHEMICALS

- SODA ASH LIGHT** : Used by Housewives/Dhobis and other Weaker Sections of the Society as also by Industries like Detergents, Silicate, Soap, Textiles, Aluminium, Dyes etc.
- SODA ASH DENSE** : Used by Ultramarine Blue, Bichromate and Glass Industries.
- SODA BiCARB** : Used for Tanning, Printing, Jaggery etc.
- CAUSTIC SODA (LYE)** : Used in Manufacture of Wood Pulp, Soap, Chemical Intermediates, Dyes, Cosmetics, Bleaching, Dyeing & Printing, Textiles, Petroleum Refining, Aluminium Manufacture, Oil Extraction, Paint and Varnish, Mercerizing Cotton.

TELEPHONES : 21735, 36 & 37

TELEGRAM : SAUKEM

TELEX : 0166-201

FAX : 0286-21431

---

ALWAYS BUY THE BEST AND THE FIRST 'THREE LIONS BRAND' PRODCTS.

---

२

## साभारे - स्वीकृते

**१. अमदावाद :** गांडी डाल अने आज (संचय) - २६. श्री मुकुट रावाळ; ५ 'पुरातत्त्वमत्तु'; गुजरात राज्य, पाचायतन लखन-५ मे भाग. अद, अमदावाद-३८०००९; ४०८८ पेण्ठ ५४ + २० + २३; १८८८; ४. अपेक्षी नथी.

विनानं शीर्षक २४, इति २१ पानांमां अध्ये गेटके ४२ + २२मा पाने २ अने २३ मा पाने १ अदा ४५ चिनो अ-८८, मुख्यापृष्ठ किपर नशु दरवाजतु' व्युरुगी अने छेक्सा मुख्यापृष्ठ किपर लास शार्थीमां सीढी सैवकनी भस्त्रिकहनी छवामय लगा, एम ४७ चिनोती समृद्ध आ पुस्तिका अमदावादां चित्प-स्थापत्येती एक दर्शनीय कंप्राप्तिरूप अनी रही छे. प्रथमां १-१८ पृष्ठोमां 'अमद वाद' ग ईकाल अने आज' ए शीर्षक निचे अमदावादानी ऐतिहासिक पार्श्वभूमितो परियत आपतां 'बद्रो छिक्को' (४) 'भातर लवानी पाव (आचारवा)' (७) 'अमदवाढाहनी भस्त्रिक (लक्ष्मी)' (७) 'सैव आतमनी भस्त्रिक (आनपुर)' (८) 'नशु दरवाज (भद्र सामें)' (८) 'राणी चिनोती भस्त्रिक (आस्तेतिया)' (८) 'राणी व्यपमोती भस्त्रिक (भिरलपुर)' (८) 'सरपिला' (११) 'कांकिरिया' (११) 'दरियापत्तनो व्युमर (शाहीआग)' (१२) 'आजमभान-मुक्ताजिमभानी भस्त्रिक अने ४८र' (१२) 'सैव आतमनी भस्त्रिक अने ४८र' (१२) 'सीढी भशीरनी भस्त्रिक (सारगपुर दरवाज लहार)' (१३) 'मुख्याजिमभानी भस्त्रिक (दीकंटा)' (१३) 'अन्युतपीयी भस्त्रिक (हुधिरय)' (१४) 'देखने स्टेचन परना भानरो' (१४) 'छिक्सानी दीवाल' (१४) 'शाहाकाम(नो रेन्नो)' (१५) 'द्वीपकम्भमकनी भस्त्रिक (सारगपुर)' (१५) 'आपु लूलनी भस्त्रिक; (जमालपुर दरवाज लहार)' (१६) 'आजमभानी चराई (भद्र)' (१६) 'शारीहेक (शाहीआग)' (१६) 'वलांदा छाव्स्तानां कांकिरिया' (१७) स्वामिनारायणतु' भादिर (कांकिरिय) अने 'हुलिसिंगतु' (वैन) भादिर (दिल्ली दरवाज लहार)' (१८) आटां स्थापत्यो विशे ग्राम्य ऐतिहासिक विगतो आपवामां आवी छे. आ पठी चिनस्पृष्ट छापो छे तेमां उपरनीचेता ज्वोडोआर्ग तेनु ते स्थान अने स्थापत्य 'हुलिसिंगतु' अने 'आज' तु जे रीते आपवामां आवेत छे. आनाथी आने ज्वेल्स्तु ते ते स्थापत्य खेल्दां फ्लू छतु' अने आने अनो तरत ख्याल आवे छे. परियत-विलागमां ते ते स्थाननो ईतिहास पछु छे गेटके ओना आपवानारामेना विषयमां मालिनी मुस्लिम नानी, पाणी, पाणी आरे अमर्पूर्वक तेवार ४२वा बद्रो पुरातत्त्वपत्तनाना नियामक्ता मुकुटभाई धन्यवादेने पात्र छे.

**२. लोकनाराय-लवाई (संचय) -** ले डॉ. कृष्णांत छडिया, ग्रंथमां शीर्षकी, छायांकी दुख संचित, गुजरात युनिवर्सिटी, अमदावाद-३८०००८; उभी ८ पेण्ठ ५० + १७२; १६५०; ४. २१/-

८२ लेट्सां पेटा-शीर्षकमां निरपेक्षा ले डन ट्यू दिवा 'लवाई' उपरने आ ग्रंथ आत्मार सुधाना नस्त्वामां आवेका लवाई विशे अने अवर्हाता प्रयोगो विशे लभ्येका वीसेक आवेमां एक आपहारी तदेवने हाथे लभाइने लहार आव्यो छे. आ ग्रंथ गुजरात युनिवर्सिटीप्रसिद्ध होइयो छे छेवानी ज्वर नथा के सामाया पछी मुनि. डारा तडिद विद्वान परमर्थीहानी चाणशुमां चाणाईने लहार आवेत छे. आस ज्वर ज्वु छू छे तर्वा लभवाता वेशीनो चिनो पाणी आपवामां आव्यो छे. लेम्ह आ विषयता ज्वालामां जितया ४ ए 'भवाई : लोकनाराय' 'भवाईतु' 'साभित्य' 'भवाईतु' 'फ्लू-म-उल' 'लज्जवर्षीनी लिन-ता' विशे शीर्षकमां ते ते पेटा अउमां लेव भगो छे. 'लवाई' ने छारेके लोकभगतमां अगो. लोक जितया छे. दूङमां 'फ्लू' होय तो 'भवाई' नां आतरिक तेम लभ उपकरणांमेणे पूरी स्पष्टता हरी छे. अत्यर सुधीमां 'लवाई' ने लगता थेमां आ ग्रंथ आगवी भात पाउनरो छे. आ ग्रंथनु प्रकाशन हरीने युजुनी आ विषये चिन्हासुनेने आयुं पूँड पाउवातुं सुचेत्य हायं ४५० छे. लेपक अने प्रकाशन सुनिवर्सिटी धन्यवादेने पात्र छे.

# મધ્યિક

‘પથિક’ પ્રત્યેક અંગ્રેજ મર્દની ૧૫ મી તારીખે પ્રસિદ્ધ થાય છે, પણના ૧૫ હિવેસમાં એક ના મળે તો રથાનિક પોસ્ટ ઓડિસ-માં વિભિત્ત ફરિયાદ કર્યા અને જેની નકલ અચે મોકુલાની.

૦ ‘પથિક’ સરેવિયોગી વિચાર-ભાવના અને તાત્ત્વ’ આચિક છે. શ્રવનને બીજ્યાની ઘનાવતી અનુષ્ઠાનિક અનુષ્ઠાની અને શિષ્ટ સાહિત્યથી લખાયેને સ્વીકારવામાં આવે છે.

૦ પ્રસિદ્ધ થઈ ગેલી કૃતિને ફરી પ્રસિદ્ધ કરવા માટે ન મોકુલાની દેખકોણે કાળજી રાખ્યી.

૦ કૃતિ સારા અન્ધરે શાહીયી અને કાગળની એક જ આજુંથી લખેલી હોવા નેટ્ઝન કૃતિના ડેક અન્ય લાખાનાં અવતરણ મુક્યાં હોય તો એંટા ચુલ્લાણી તરજૂમે આપવો જરૂરી હૈ.

૦ કૃતિમંત્ર વિચારેની જવાબદારી લેખકની રહેશે.

૦ ‘પથિક’નું પ્રસિદ્ધ થતી ઇતિ-ખોના વિચારો-આચારયા આવે તંત્રી સહયોગ એમ ન સહજું.

૦ અસ્તીકૃત કૃતિ પાત્રી મેળવ-વા જરૂરી ટિકિટો આવી દ્વો તો તરત પરત કરશે.

૦ નમૂનાના અંકના નકલ માટે રૂ.૫૦ ની ટિકિટો મોકુલાની.

મ.એસ. ડાઝન્ડ પોસ્ટ લેખા પથિક કાર્યાલય, મહુવાન, અલિસ-અંજ અમદાવાદ-૩૮૦૦૦૬

પથિક

આધ તંત્રી : સ્વ. માનસંગળ આરંધ

તંત્રી-મંડળ( ) વાર્ષિક લખાનમ : દેશમાં રૂ.૩૦/-  
ગ્રા.કે. ડા. શાસ્ત્રી ( ) વિદેશમાં રૂ. ૧૧૨/-, લુણ ૨૦. ૪/-

૨. ડૉ. નાગરલાલ ભટ્ટી, ૩. ડૉ. લારતીભાઈલ શેલત  
વર્ષ ૩૦) પૌષ., સં. ૨૦૪૭ : જાન્યુ., સને ૧૯૯૨ [અંક ૪]

## અનુકૂળ

સાધારણ રવીશાર	તંત્રી	પૂરી ૨
ભારતીય રાખનશોની પરંપરા	શ્રી કરણસિંહ ચૂંગામા	૩
વહેસંઘાનો ઇતિહાસ (એક હસ્તપ્રત)	ડૉ. અમ. અ. કુરોણી	૬
પારવી તાલુકાના આદિવાસીઓનાં	ડૉ. ગ્ર. લે. દેસાઈ	૧૩
દેવ-દેવીઓ	અને ગ્રો. ભી. અન. જોદી	
માઇન્ટ આયુ અને ચુલ્લરાત	શ્રી કસુય વ્યાસ	૧૬
મહરસંક્રિતિનું દેખવેનિધે નંતુર્ભ	શ્રી દીપક જગતાય	૨૨
આધ્રીના વિર રૌનિક (સત્પથથા)	ડૉ. અધ્યકુમાર શુલ્ક	૨૨
ઘોંબાઈ માતાજી	શ્રી વીરભદ્રસિંહ સેવાંડા	૨૪
કૃષ્ણ : ઇતિહાસ અને સંકૃતિ	શ્રી ડાકરસી પુ. કંસાર રૂ.૧૦૫ (પાદીપો)	

## વિનંતિ

વાર્ષિક આંકડેઓ પોતાતું કે પોતાની સંસ્થા કાંદેશ થાયાતું લખાનમ રૂ. ૩૦/- હજુ ન મોકદ્યું હોય તો સત્ત્રર મ.ગ્ર.થી મોકલી આપવા છાંદિક વિનંતિ સરનામામાં ગોળ બતુંનું પડકો અંક કરા માટ્યું આહુક ચચાતું કરે છે. એ માસ પહેલાં લખાનમ મળતું અચીંદ છે. અગાઉના લખાનમ એક કે એકથી વધુ વરોની વાજી છે તેણા પણ સવેળા મોકલી આપવા કૂચા કરે. અંક હાથમાં આવે એ ગાળાના લખાન મોકલી આપનારે આના વર્તુલને ધ્યાનમાં ન લેવા વિનંતિ. પાંદુકના આશ્રમથાત. રૂ. ૧૦૦/-થી અને આશ્રમન સહાય રૂ. ૩૦/-થી ચચાતું છે. કેટ તરીકે પણ રકમો સ્વીકારવામાં આવે છે. સ્વ. માનસંગળાઈના અને ‘પથિકના ચાહકેને પથિક કાર્યાલયના નામના મ.ગ્ર. ડાઝન્ડથી મોકલી આપવા વિનંતિ. આ છેલ્લી એ પ્રકારી તેમ રૂ. ૫૦ થી લઈ આવી વધુ ભેટની રકમ ઘનામત જ રહે છે અને એનું માત્ર વ્યાજ રૂ. ૫૦ પરાય છે.

જાન્યુઆરી/૧૯૯૨

૧

૧૦

## ઇતिहાસ એક અરણી શિક્ષક, માર્ગદર્શિક છે.

અતીતની એક આજી પેઠી જીવનની પાયાની વણું બાબતોને આખારે  
બસું બસું જીવી ગઈ :

**૧. ભૂતકાળનું ગૌરવ**

**૨. વર્તમાનની પીડા**

**૩. ભવિષ્યનું સ્વરૂપ**

સાંપ્રતનાં જીવતા આપણા સૌ ઉપર આવનારી પેઠીની અનાગત જવાબદારી છે.



આપણે ઇતિહાસ પાસેથી મન-યુદ્ધની આંખ ઝુલ્લી  
રાખી કરી બાણી શકીએ ?



કાન ઝુલ્લા રાખી ઇતિહાસ પાસેથી માર્ગદર્શન મેળથી  
શકીએ ?  
જીવી શકીએ ?

આ દિશાના પ્રથમનો કરીએ તો આવનારો સમય ઉત્તીવળ છે.  
સૌઝન્ય :



**એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ, લિ.**  
૬/૨ ઇવાપરી રોડ, ભાવનગર-૩૬૪૦૦૫  
ફોન : ૨૪૨૨૨-૨૩-૨૪

૧૧

## ભારતીય રાજ્યવંશોની પરંપરા

શ્રી. કરણાળિલુ ગો. ચૂડાસમાં

[ 'પથિક'-જુલાઈ-૧૯૬૦ ના અંગરી વિરાદ્વાંશ (પૃ. ૩-૭ માં) છ્યાયો હતો. આ ચૂડાસમાં ભારતીય રાજ્યવંશોની પરંપરા ભારતીય રાજ્યવંશોની પરંપરા ભારતીય રાજ્યવંશોની પરંપરા અને અમૃત્યુક તોપર કરી છે તે અમને મોકલી આપી હતી. અમારે માટે પણ એ અભ્યાસનો વિષય હોઈ એ વિવારણામાં રાખી હતી. એને આપવા જેવું સ્વફ્ત આપવામાં વિષય થયો છે, વર્ષે ઓઠોઠો-નવે-હિસેના અંક દીપોત્સવાંક અને એની પૂર્તિદ્વારે છ્યાય તેવી વધુ વિષય થયો, હવે જાન્યુ-ઝીઝુંમાં એ વધુસ્થિત રીતે આવશે. એક રીતે આ ખુલ્લાયેલો વિષય છે, એ ઉદ્દેશે જ પૌરાણિક વંશાવળીઓ એ શાર્ણિકી એપ્રિલ-૬૦ ના 'પથિક'માં (પૃ. ૧૫-૨૩ અને ૨-૧૧, ૧૩) શ્રી જાદુ લા. પાનીટરના 'એન્થ્યેનન્ટ ઇન્ડિયન ડિસ્પ્લાઇન ટ્રેડિંગન (૧૯૮૨)'માથી અમારા વિવેચન સાથે સર્વાંગંશ અને પેટાશાભાગ્યાની વંશાવળીઓ આપવામાં આવી હતી. આ વંશાવળીઓ સાથે રાજતાં શ્રી ચૂડાસમાં આપેલી વંશારણીઓ સમજગાની વધુ સરળતા થયો. વંશાવળીઓને કંપાન સહજીબી સુની વાતનો એમણે છ વિશ્વાસો નિયે પ્રયત્ન કરી છે, જેનો સમાર કરતાં આનંદ થાય છે.

-તંત્રી ]

### વિશ્વાસ ૧

**કૃતયુગ [ સત્તાધીર ] વિ. ખા.પૂ. ૧૨૨૪૪ થી ૧૨૪૪ : કુલ વર્ષ ૩૬૦૦**

૭ અને : (૧) મરીયિ, (૨) અગ્નિ, (૩) વિધિ, (૪) વાસેષઠ, (૫) પુરવલ્ય, (૬) પુરણ, (૭) કંઈ  
સૂર્યવંશ : શાખા ૧ શાખા ૨ વંશવંશ : શાખા ૧ શાખા ૨ શાખા ૩ શાખા ૪  
૧ મરીયિ ૧ અન્નિ

૨ ઈષ્યપ

૩ વિષસ્વાન

૪ દૈવરવત

૫ ધિક્ષાઙ્ક

૬ વિકુલિ

૭ શાદ

૮ દાયત

૯ પૂર્ણય

૧૦ અનેતા

૧૧ પુરુ

૧૨ વિષરથ

૧૩ ચંદ્ર

૧૪ પુરુનાય

૧૫ અવિરથ

૧૬ પુરુદ્વથ

૧૭ કેવલાય

૧૮ દાય

૧૯ પથિક

નિમિ સંભાતિર	૨ ચંદ્ર-સોમ	૩ શુષ્ઠ	૪ પુરુરવા	૫ આયુ	વિજય
૬ નંદ	૬ નંદ	૭ નંદ	૮ નંદ	૯ નંદ	૧૦ નંદ
૭ યથાતિ (૧)		૮ યથાતિ (૨)		૯ યથાતિ (૩)	૧૧ યથાતિ (૪)
૮ યથાતિ (૨)		૯ યથાતિ (૩)		૧૦ યથાતિ (૫)	૧૨ યથાતિ (૬)
૯ યથાતિ (૩)		૧૦ યથાતિ (૪)		૧૧ યથાતિ (૫)	૧૩ યથાતિ (૬)
૧૦ યથાતિ (૫)		૧૧ યથાતિ (૬)		૧૨ યથાતિ (૭)	૧૪ યથાતિ (૮)
૧૧ યથાતિ (૬)		૧૨ યથાતિ (૭)		૧૩ યથાતિ (૮)	૧૫ યથાતિ (૯)
૧૨ યથાતિ (૭)		૧૩ યથાતિ (૮)		૧૪ યથાતિ (૯)	૧૬ યથાતિ (૧૦)
૧૩ યથાતિ (૮)		૧૪ યથાતિ (૯)		૧૫ યથાતિ (૧૦)	૧૭ યથાતિ (૧૧)
૧૪ યથાતિ (૯)		૧૫ યથાતિ (૧૦)		૧૬ યથાતિ (૧૧)	૧૮ યથાતિ (૧૨)
૧૫ યથાતિ (૧૦)		૧૬ યથાતિ (૧૧)		૧૭ યથાતિ (૧૨)	૧૯ યથાતિ (૧૩)
૧૬ યથાતિ (૧૧)		૧૭ યથાતિ (૧૨)		૧૮ યથાતિ (૧૩)	૨૦ યથાતિ (૧૪)
૧૭ યથાતિ (૧૨)		૧૮ યથાતિ (૧૩)		૧૯ યથાતિ (૧૪)	૨૧ યથાતિ (૧૫)
૧૮ યથાતિ (૧૩)		૧૯ યથાતિ (૧૪)		૨૦ યથાતિ (૧૫)	૨૨ યથાતિ (૧૬)
૧૯ યથાતિ (૧૪)		૨૦ યથાતિ (૧૫)		૨૧ યથાતિ (૧૬)	૨૩ યથાતિ (૧૭)
૨૦ યથાતિ (૧૫)		૨૧ યથાતિ (૧૭)		૨૨ યથાતિ (૧૮)	૨૪ યથાતિ (૧૯)
૨૧ યથાતિ (૧૭)		૨૨ યથાતિ (૧૯)		૨૩ યથાતિ (૨૦)	૨૫ યથાતિ (૨૧)
૨૨ યથાતિ (૧૯)		૨૩ યથાતિ (૨૧)		૨૪ યથાતિ (૨૨)	૨૬ યથાતિ (૨૩)
૨૩ યથાતિ (૨૧)		૨૪ યથાતિ (૨૩)		૨૫ યથાતિ (૨૪)	૨૭ યથાતિ (૨૫)
૨૪ યથાતિ (૨૩)		૨૫ યથાતિ (૨૫)		૨૬ યથાતિ (૨૬)	૨૮ યથાતિ (૨૭)
૨૫ યથાતિ (૨૫)		૨૬ યથાતિ (૨૭)		૨૭ યથાતિ (૨૮)	૨૯ યથાતિ (૨૯)
૨૬ યથાતિ (૨૭)		૨૭ યથાતિ (૨૯)		૨૮ યથાતિ (૩૦)	૩૦ યથાતિ (૩૧)
૨૭ યથાતિ (૨૯)		૨૮ યથાતિ (૩૧)		૨૯ યથાતિ (૩૨)	૩૧ યથાતિ (૩૩)
૨૮ યથાતિ (૩૧)		૨૯ યથાતિ (૩૩)		૩૦ યથાતિ (૩૪)	૩૨ યથાતિ (૩૫)
૨૯ યથાતિ (૩૩)		૩૦ યથાતિ (૩૫)		૩૧ યથાતિ (૩૬)	૩૩ યથાતિ (૩૭)
૩૦ યથાતિ (૩૫)		૩૧ યથાતિ (૩૭)		૩૨ યથાતિ (૩૮)	૩૪ યથાતિ (૩૯)
૩૧ યથાતિ (૩૭)		૩૨ યથાતિ (૩૯)		૩૩ યથાતિ (૪૦)	૩૫ યથાતિ (૪૧)
૩૨ યથાતિ (૩૯)		૩૩ યથાતિ (૪૦)		૩૪ યથાતિ (૪૧)	૩૬ યથાતિ (૪૨)
૩૩ યથાતિ (૪૦)		૩૪ યથાતિ (૪૧)		૩૫ યથાતિ (૪૨)	૩૭ યથાતિ (૪૩)
૩૪ યથાતિ (૪૧)		૩૫ યથાતિ (૪૨)		૩૬ યથાતિ (૪૩)	૩૮ યથાતિ (૪૪)
૩૫ યથાતિ (૪૨)		૩૬ યથાતિ (૪૩)		૩૭ યથાતિ (૪૪)	૩૯ યથાતિ (૪૫)
૩૬ યથાતિ (૪૩)		૩૭ યથાતિ (૪૪)		૩૮ યથાતિ (૪૫)	૪૦ યથાતિ (૪૬)
૩૭ યથાતિ (૪૪)		૩૮ યથાતિ (૪૫)		૩૯ યથાતિ (૪૬)	૪૧ યથાતિ (૪૭)
૩૮ યથાતિ (૪૫)		૩૯ યથાતિ (૪૬)		૪૦ યથાતિ (૪૭)	૪૨ યથાતિ (૪૮)
૩૯ યથાતિ (૪૬)		૪૦ યથાતિ (૪૭)		૪૧ યથાતિ (૪૮)	૪૩ યથાતિ (૪૯)
૪૦ યથાતિ (૪૭)		૪૧ યથાતિ (૪૯)		૪૨ યથાતિ (૫૦)	૪૪ યથાતિ (૫૧)
૪૧ યથાતિ (૪૯)		૪૨ યથાતિ (૫૦)		૪૩ યથાતિ (૫૧)	૪૫ યથાતિ (૫૨)
૪૨ યથાતિ (૫૦)		૪૩ યથાતિ (૫૧)		૪૪ યથાતિ (૫૨)	૪૬ યથાતિ (૫૩)
૪૩ યથાતિ (૫૧)		૪૪ યથાતિ (૫૨)		૪૫ યથાતિ (૫૩)	૪૭ યથાતિ (૫૪)
૪૪ યથાતિ (૫૨)		૪૫ યથાતિ (૫૩)		૪૬ યથાતિ (૫૪)	૪૮ યથાતિ (૫૫)
૪૫ યથાતિ (૫૩)		૪૬ યથાતિ (૫૪)		૪૭ યથાતિ (૫૫)	૪૯ યથાતિ (૫૬)
૪૬ યથાતિ (૫૪)		૪૭ યથાતિ (૫૫)		૪૮ યથાતિ (૫૬)	૫૦ યથાતિ (૫૭)
૪૭ યથાતિ (૫૫)		૪૮ યથાતિ (૫૬)		૪૯ યથાતિ (૫૭)	૫૧ યથાતિ (૫૮)
૪૮ યથાતિ (૫૬)		૪૯ યથાતિ (૫૭)		૫૦ યથાતિ (૫૮)	૫૨ યથાતિ (૫૯)
૪૯ યથાતિ (૫૭)		૫૦ યથાતિ (૫૯)		૫૧ યથાતિ (૫૯)	૫૩ યથાતિ (૬૦)
૫૦ યથાતિ (૫૯)		૫૧ યથાતિ (૬૦)		૫૨ યથાતિ (૬૧)	૫૪ યથાતિ (૬૨)
૫૧ યથાતિ (૬૦)		૫૨ યથાતિ (૬૧)		૫૩ યથાતિ (૬૨)	૫૫ યથાતિ (૬૩)
૫૨ યથાતિ (૬૧)		૫૩ યથાતિ (૬૨)		૫૪ યથાતિ (૬૩)	૫૬ યથાતિ (૬૪)
૫૩ યથાતિ (૬૨)		૫૪ યથાતિ (૬૩)		૫૫ યથાતિ (૬૪)	૫૭ યથાતિ (૬૫)
૫૪ યથાતિ (૬૩)		૫૫ યથાતિ (૬૪)		૫૬ યથાતિ (૬૫)	૫૮ યથાતિ (૬૬)
૫૫ યથાતિ (૬૪)		૫૬ યથાતિ (૬૫)		૫૭ યથાતિ (૬૬)	૫૯ યથાતિ (૬૭)
૫૬ યથાતિ (૬૫)		૫૭ યથાતિ (૬૭)		૫૮ યથાતિ (૬૮)	૬૦ યથાતિ (૬૯)
૫૭ યથાતિ (૬૭)		૫૮ યથાતિ (૬૮)		૫૯ યથાતિ (૬૯)	૬૧ યથાતિ (૭૦)
૫૮ યથાતિ (૬૮)		૫૯ યથાતિ (૬૯)		૬૦ યથાતિ (૭૦)	૬૨ યથાતિ (૭૧)
૫૯ યથાતિ (૬૯)		૬૦ યથાતિ (૭૦)		૬૧ યથાતિ (૭૧)	૬૩ યથાતિ (૭૨)
૬૦ યથાતિ (૭૦)		૬૧ યથાતિ (૭૧)		૬૨ યથાતિ (૭૨)	૬૪ યથાતિ (૭૩)
૬૧ યથાતિ (૭૧)		૬૨ યથાતિ (૭૨)		૬૩ યથાતિ (૭૩)	૬૫ યથાતિ (૭૪)
૬૨ યથાતિ (૭૨)		૬૩ યથાતિ (૭૩)		૬૪ યથાતિ (૭૪)	૬૬ યથાતિ (૭૫)
૬૩ યથાતિ (૭૩)		૬૪ યથાતિ (૭૪)		૬૫ યથાતિ (૭૫)	૬૭ યથાતિ (૭૬)
૬૪ યથાતિ (૭૪)		૬૫ યથાતિ (૭૫)		૬૬ યથાતિ (૭૬)	૬૮ યથાતિ (૭૭)
૬૫ યથાતિ (૭૫)		૬૬ યથાતિ (૭૭)		૬૭ યથાતિ (૭૮)	૬૯ યથાતિ (૭૯)
૬૬ યથાતિ (૭૭)		૬૭ યથાતિ (૭૮)		૬૮ યથાતિ (૭૯)	૭૦ યથાતિ (૮૦)
૬૭ યથાતિ (૭૮)		૬૮ યથાતિ (૭૯)		૬૯ યથાતિ (૮૦)	૭૧ યથાતિ (૮૧)
૬૮ યથાતિ (૭૯)		૬૯ યથાતિ (૮૦)		૭૦ યથાતિ (૮૧)	૭૨ યથાતિ (૮૨)
૬૯ યથાતિ (૮૦)		૭૦ યથાતિ (૮૧)		૭૧ યથાતિ (૮૨)	૭૩ યથાતિ (૮૩)
૭૦ યથાતિ (૮૧)		૭૧ યથાતિ (૮૨)		૭૨ યથાતિ (૮૩)	૭૪ યથાતિ (૮૪)
૭૧ યથાતિ (૮૨)		૭૨ યથાતિ (૮૩)		૭૩ યથાતિ (૮૪)	૭૫ યથાતિ (૮૫)
૭૨ યથાતિ (૮૩)		૭૩ યથાતિ (૮૪)		૭૪ યથાતિ (૮૫)	૭૬ યથાતિ (૮૬)
૭૩ યથાતિ (૮૪)		૭૪ યથાતિ (૮૫)		૭૫ યથાતિ (૮૬)	૭૭ યથાતિ (૮૭)
૭૪ યથાતિ (૮૫)		૭૫ યથાતિ (૮૬)		૭૬ યથાતિ (૮૭)	૭૮ યથાતિ (૮૮)
૭૫ યથાતિ (૮૬)		૭૬ યથાતિ (૮૭)		૭૭ યથાતિ (૮૮)	૭૯ યથાતિ (૮૯)
૭૬ યથાતિ (૮૭)		૭૭ યથાતિ (૮૯)		૭૮ યથાતિ (૯૦)	૮૦ યથાતિ (૯૦)
૭૭ યથાતિ (૮૯)		૭૮ યથાતિ (૯૦)		૭૯ યથાતિ (૯૧)	૮૧ યથાતિ (૯૧)
૭૮ યથાતિ (૯૦)		૭૯ યથાતિ (૯૧)		૮૦ યથાતિ (૯૨)	૮૨ યથાતિ (૯૨)
૭૯ યથાતિ (૯૧)		૮૦ યથાતિ (૯૨)		૮૧ યથાતિ (૯૩)	૮૩ યથાતિ (૯૩)
૮૦ યથાતિ (૯૨)		૮૧ યથાતિ (૯૩)		૮૨ યથાતિ (૯૪)	૮૪ યથાતિ (૯૪)
૮૧ યથાતિ (૯૩)		૮૨ યથાતિ (૯૪)		૮૩ યથાતિ (૯૫)	૮૫ યથાતિ (૯૫)
૮૨ યથાતિ (૯૪)		૮૩ યથાતિ (૯૫)		૮૪ યથાતિ (૯૬)	૮૬ યથાતિ (૯૬)
૮૩ યથાતિ (૯૫)		૮૪ યથાતિ (૯૬)		૮૫ યથાતિ (૯૭)	૮૭ યથાતિ (૯૭)
૮૪ યથાતિ (૯૬)		૮૫ યથાતિ (૯૭)		૮૬ યથાતિ (૯૮)	૮૮ યથાતિ (૯૮)
૮૫ યથાતિ (૯૭)		૮૬ યથાતિ (૯૮)		૮૭ યથાતિ (૯૯)	૮૯ યથાતિ (૯૯)
૮૬ યથાતિ (૯૮)		૮૭ યથાતિ (૯૯)		૮૮ યથાતિ (૧૦૦)	૯૦ યથાતિ (૧૦૦)
૮૭ યથાતિ (૯૯)		૮૮ યથાતિ (૧૦૦)		૮૯ યથાતિ (૧૦૧)	૯૧ યથાતિ (૧૦૧)
૮૮ યથાતિ (૧૦૦)		૮૯ યથાતિ (૧૦૧)		૯૦ યથાતિ (૧૦૨)	૯૨ યથાતિ (૧૦૨)
૮૯ યથાતિ (૧૦૧)		૯૦ યથાતિ (૧૦૨)		૯૧ યથાતિ (૧૦૩)	૯૩ યથાતિ (૧૦૩)
૯૦ યથાતિ (૧૦૨)		૯૧ યથાતિ (૧૦૩)		૯૨ યથાતિ (૧૦૪)	૯૪ યથાતિ (૧૦૪)
૯૧ યથાતિ (૧૦૩)		૯૨ યથાતિ (૧૦૪)		૯૩ યથાતિ (૧૦૫)	૯૫ યથાતિ (૧૦૫)
૯૨ યથાતિ (૧૦૪					

१८ धर्मात्	मुकेत	१२ धर्माति (१)	राष्ट्रवीर	कोपन
२० संदर्भ				
२१ वक्तुल	यदु		पुड़(२)	
२२ वस्त्रोरप				
२३ कुशाश्व	देवरात	कोषटा	सहस्रनिति	पुड़(२)
२४ सेतनिति		संडेव	सत्यनिति	पुड़(३)
२५ चुलनाथ		स्वार्णित	हेद्य	पुड़(४)
२६ मांधारा	भृद्ग्रथ	चित्ररथ	धर्म	दीर्घतमा
२७ अंगरीप				पुड़(५)
२८ वैवनाश्व				
२९ पृथु		शुचियांधु	कुंति	जनमेष्य
३० निराङ्कु	भडावीर	वानसनाति	सोनानी	प्राचिन्यान
३१ हंसिन्ध्र			महिषान	धनंतरि
				अमर्य
३२ शैक्षित				
३३ हारीत		युहुद्वं	बद्रोन	प्रवीर
३४ चंपक			देवनीर्थ	नमस्यु
३५ सुधृते	सुधृति	चित्ररथ	दुर्मेह	
३६ विजय			संडसार्जुन	
३७ मदुवृक्ष		जनामध		अनातश्चन्तु
३८ पृष्ठ-सरत				अपह
३९ असित	धृष्टदेव	शशियांधु	तालमध	सुधृतु
				पृष्ठ
विद्याम् २				
व्रेतायुग वि.स.पू ८८४ थी ४८४ : पुल वर्ष २३००				
अग्निधा नियिदा शायस्यपुरी भ्रतिनानपुरी भाहिष्मती इदमस्य काशा गिरिमल				
मधुरा-यदुवंश यदुशाया पुरुषवंश क्षत्र वसुवंश				
४० संग्र	१४ धैर्यन	२४ पृथुशुभा	२४ यदुवंश	१६(३५)
४१ असमंजस		हेष्वप्नंश	२४ यदुनान	भृद्ग्रथ
४२ अंशुमान	१५ मदु	२५ धर्म	२५ संयाति	२० वसु
४३ हितीप				
४४ अग्निरथ	१६ भ्रतिन-वड	२६ उशना	२६ अहयति	२०७८८(२)
४५ त्रुतरोन		२७ अद्यक्ष		
४६ नाक्ष-नाक्षाग	१७ भ्रातिरथ	२८ भ्रुविति	२७ शैक्षित	२२ वृष्टद्वय
* अर्थव				
४७ संवृद्धीप	१८ देवमीठ	२८ जनामध	२८ ऋतेयु	
४८ अद्युतायु				२३ भ्रतवाहन
४९ अर्थपर्य	१९ विषुष	३० विद्या	२८ रंतिनास	२४ सीवेल्व
			आनुष्मारी/१६६१	पथिक

५० सर्वदाम	२० भट्टिन्धक	३२ कुति	३० सार्वलोन	२५ ५६
५१ सूदास		३३ धृष्टि	३१ ज्ययतेन	२६ संभू
५२ असमक	२१ कुतिराज	३४ निर्णिति	३२ अवीचीन	
५३ नारीकृपय			३३ अरिह(१)	२७ सूक्षेत्र
५४ दशरथ	२२ महारोगा	३५ हथार्थ	३५ महालाम	२८ शब्दन
५५ पूर्णिं		३६ व्योगा	३७ आडोगन	२९ दुति
५६ विष्वसद		३७ अमृता	३८ देवातिथि	३० उपरियर
५७ अट्टोग	२३ रव्यरोगा	३८ छविष्टुत	३७ अजगोद(१)	३१ वृक्षद
[५८ हाथार्गा]			३८ अस्ति	३२ दुखाम
५९ रथु		३९ वीररथ	३६ अरिह(२)	३३ ग्राम
६० अज	२४ हृषीरोगा	४० नवरथ	४० हस्ती	३४ परंतप
६१ दशरथ	२५ विष्ववृत्त	४१ दशरथ		३५ सुभित्र
	कुतिराज			

## विशाख उ

द्वापरयुग : महाकाशरत-प्रसंगना समय सुधी वि.सं. ५८४४ थी ३०४४  
रुप०० कुलवर्ष

६२ रामयद (साता- २६ धर्मध्यज्ञ ४२ शकुनि	४२ अतिनार	४२ अतिनार	सुभित्र
बर्मिला)(भृङ्गी शुक्राक्षिति)			
शिरध्यज्ञ कुतिराज	तात्पर्य	क्षत्रिय	३५ सुहर्दीन
६३ कुरा	४२ कुतिराज	४२ तंशु	
६४ अतिथि	४२ कुतिराज	४३ धतिन	
६५ विषाद	४२ भासुमान	४४ देवरात	
६६ नक्ष	३० शतघुम	४४ शेष्य	
६७ पुंडीरी	३१ शुभ्य	४५ देवक्षम	४५ दुर्यात
६८ क्षेमधन्वा		४६ अमृ	४६ अरत
६९ देवानिक	३२ अनुरोग		४७ भूमन्तु
७० छीन	३३ जिर्णित	४८ कुतिराज	४८ वृहद्येत्र
७१ परियात्र	३४ पुरुषित		
७२ वक्षरथ	३५ अरिष्टेनि	४८ ततु	४९ कुसिताथ
			४७ पुरुषगाम्य
७३ वृष्णिनाम	३७ शुतायु	४८ पुरुषेन	४० अगमीद(३)
७४ चगाथु	४८ सूर्योद		४८ उपरियर(२)
७५ चुणम	४८ चित्ररथ	५० आयु	५१ अक्षराज
७६ विष्टुति	४० क्षेमापि	५१ सातरक	५२ संवरथ
७७ हिरण्यनाम	४१ समरथ		५३ कुटुराज
७८ पुण्य	४२ सत्यरथ	५२ भजमान	५४ जहन्तु
७९ कुत्र	४३ उपगुरु	५३ विहुरथ	५५ सुरथ
८० धृथ			
		आनुमारी/१६६१	

૮૦ સંખ્ય	૪૪ વદ્વાત	૫૪ થર	૫૬ વિદુરથ
૮૧ સુદર્શન			
૮૨ અનિરથ્ર	૪૫ પર્યાવાન	૫૫ લક્ષ્માન	૫૭ સાર્વભૌમ
૮૩ શીધ	૫૫ સુભાપથ	૫૬ શિનિ	૫૮ જ્યસેન
૮૪ મદુ			
૮૫ પૃથુસેન	૪૭ શુરુ	૫૭ રવયંભજ	૫૯ આહોધન
૮૬ અમદોષુ	૪૮ એવ	૫૮ રવિક	૬૦ જલ
૮૭ મહાયાત	૪૯ વિજય	૫૯ હેવમાણ	૬૧ વિલિય
૮૮ વિશ્વાષુ	૫૦ અંતુ		૬૨ અતીપ
૮૯ પ્રેસેનાભિત	૫૧ વીતદીષ	૬૦ વસુદેવ	૬૩ શાંતિ
૯૦ તશ્છ	૫૨ ધૂતિ		૬૪ વિચિત્રવીર્ય
			૬૫ પાંડુ

૬૧ પુણ્યદાલ ૫૩ અહુલાશ્વ ૬૧ શ્રીદ્ગઢુનીલારાજ ૬૬ ગુણિકિર ૪૩ જરાસંધ

### વિશ્વામ ઽ

મહાકારત પ્રસંગના સમયથી ઓદ્ધોકાલ યુધિ. સં. ૧ થી ૧૬૫૨

વિસ. પૂ. ૩૦૪૪ થી ૧૦૮૮ કુદી વર્ષ ૧૬૫૨

અયોધ્યા	મિથિયા શાકાશ્યપુરી	દ્વારકા-શોષિત દિદ્પ્રથ	રાજ્યકાલ કોશલ ગિરિવજ
૬૧ પુણ્યદાલ પુણ્યદાલ	૪૮ અહુલાશ્વ	૬૧ શ્રીદીષ	૬૬ પુણિકિર ૩૬-૦-૦ (પુણિંશ શાખા) વસુનંદ
૬૨ અહુલાશ્વ	ત્રિતોરા	૬૨ અનિનુદ્ધ	૬૭ અભિમન્દુ
૬૩ પિરુસેપ	સુપ્રતાષ	૬૩. વજનાલ	૬૮ પરાક્ષિત ૫૦-૦-૦
૬૪ વત્સપાલ		૬૪ પ્રતિપાદ	૬૯ જનમેળય ૮૪-૩-૧૩
૬૫ પ્રતિશર્મા	અશ્વસેન	૬૫ સુમાષુ	૭૦ શાતાનીક ૮૨-૮-૨
૬૬ દેવક	શાકરાજ	૬૬ શાતીતસેન	૭૧ સહાયાંનાંક ૮૮-૨-૮
૬૭ સહદેવ		૬૭ સય્યદેસેન	૭૨ અયોદ્ધેષ ૮૧-૧૧-૨૭ ૭૧ દેવાતિ ૪૮ ઉસેન
૬૮ પુણ્યદાલ		૭૮ સુંપણુ	૭૩ અસીમદ્વારુષ ૭૫-૭-૧૮ ૭૨ સાંત કોમ ૭૯ થરસેન
૬૯ ભાતુરેન	ધૂહનજ	૭૬ ગોવિદ્વાર ૭૪ નિમિયાં ૭૫-૧-૧૪ ૭૪ જ્વયસેન ૫૦ સુલનપતિ	
૧૦૦ સુપ્રતીષ્ઠ		૭૦ સુર્યમલ્લ	૭૫ ચિદ્વતરથ ૭૮-૭-૨૧ ૭૪ અદ્ભુતિ ૫૧ ચુચ્છ
૧૦૧ મરુદેવ	રહ્ય	૭૧ સાંતિવર્ણન ૭૫ હનીરથ ૮૮-૭-૨૦ ૭૫ દ્વારાત ૫૨ સુખહેવ	
૧૦૨ શુનસીપ		૭૨ સાયદિવથ ૭૭ દાયિત્વમાન ૬૬-૫-૬ ૭૬ હોણાંદ ૫૩ શુદ્ધયરથ	
૧૦૩ કૃતીનર	કૃતાંજ્ય	૭૩ વિશ્વરાહ ૭૮ સુશ્રાવ ૫૫-૧૦-૪ ૭૭ દેવઃ ૫૪ પર્વતસેન	
૧૦૪ અંતરિક્ષ		૭૪ એંગાર ૭૬ સુનીય ૬૪-૬-૪ ૭૮ માનિવર ૫૫ મેખાની	
૧૦૫ સુવધ્યાંગ		૭૫ હરિરાજ ૮૦ પુણ્ય ૬૨-૦-૧૪ ૭૭ કાટ્યાયન ૫૬ સેનનીર	
૧૦૬ અભિનાભિત		૭૬ સીમ ૮૧ કૃપીનાલ ૫૧-૧૦-૧ ૮૦ નિમિ ૫૭ લીમહેવ	
૧૦૭ પુણ્યદાલ	સંઘ્ય	૭૭ લીમ ૮૨ પરીલાલ ૪૨-૧૧-૨ ૮૧ દુધ્વાત ૫૮ પૂર્વમલ્લ	
૧૦૮ ધર્મરાજ		૭૮ કોંજ ૮૩ સુનાલ ૫૮-૧૦-૮ ૮૨ સુયોગ ૫૯ હરણી	
૧૦૯ કૃતાંજ્ય	સાગોંજ	૭૯ રાજમાણિકિર ૮૪ મેખાણી ૫૫-૮-૧૦ ૮૩ હારિત ૫૦ જ્યયતાલ	

જાન્યુઆરી/૧૬૬૨

પથ્ય

११० राजविष्णु	८० महीपाल	८५ वृंदाबन ५९-१०-१०	८४ भरत	५१ अधिकेश
१११ संजय	८१ भगव	८६ हुक्म ५०-८-२१	८५ विरोचन	५२ कुमुल
११२ शाक्यवर्धन	८२ भूषण	८७ निमि ४७-८-२०	८६ अजमीठ	५३ सोनवीर
११३ द्विष्ठानित	८३ व्युहव	८८ व्युहव ४५-११-२३	८७ संवरथ	५४ वीरभाव
११४ अतुलविक्रम	८४ विष्णु	८९ भद्रीपाल	८८ वृंदास ४४-८-७	५५ रिष्टुंजय
११५ प्रसेनजित	८५ विष्णु	९० विष्णुनित	९० विष्णुनित	५६ प्रसेन(१)
११६ शशि	८६ विष्णु	९१ हुक्मन ५०-११-८	९० वीरसेन	२, (२)
११७ मुरु	९१ विष्णु	९२ विष्णुन ३५-८-०	९१ विष्णुन	३, (३)
११८ (झुमित्र)	९३ विष्णु	९३ विष्णुनित ४०-१०-२५	९२ क्षेमक	४ चंद्रघोष
(नामवर्णा)	९४ विष्णु	९४ विष्णु	९४ विष्णु	५ संभ्रान्ति
<hr/>				
१५ विष्णुवरह				
६० भूषण	६५ विष्णु	६८-५-८	नरवाहन	१ विष्णुनाग
६१ भूषण	१ विष्णु	७७-३-२८	शतानीठ	२ द्विष्ठान
६२ भूषण	२ विष्णु	८२-८-२१	३ विष्णु	३ विष्णु
६३ भूषण	३ विष्णु	८२-१०-७	४ विष्णु	४ विष्णु
६४ भूषण	४ विष्णु	८३ विष्णु	५ विष्णु	५ विष्णु
<hr/>				
गोभतयुक्त	६४ विष्णु	६४ विष्णु	६५ विष्णु	६५ विष्णु
<hr/>				
विष्णुम् ५				

कुलियुगः औधकाली विष्णुः १ सुमी, युधि-सः १८५८ श्री ३०४४

चंद्रवर्णा	विष्णुवाहन	विष्णुवरह	राज्यकाल	परमार	नामवर्णा
पुरुषपुर	१ द्विष्ठान	३ विष्णु	३५-६-११	५४४पति	१ विष्णुनाग
६४ चायु३	५ विष्ठित	४४-२-२२	६३. विष्णु	६. अलतशुभ्र	२ द्विष्ठान
६५ पुरुषसेथी	६ विष्णु	३०-२-२१	१ सुमी	३५४	३ विष्णु
६६ सुभपाल	७ विष्णु	४२-८-२४	२ विष्णुद्वारा४	७८-७-१४	४ विष्णु
६७ भर्त्तेन	८ कुटु	३२-२-१४	३ विष्णु	४ भर्त्तेन	५ भर्त्तेन
६८ संजन	९ संजन	४०-२-१४	४ भर्त्तेन		
<hr/>					
६९ विष्णु	१० अभरत्यु	२१-३-१५	५. नरै		८ विष्णु
	११ अभीपाल	२२-११-२५	६. अधिकेश		१. नंदिवर्धन
७० शालिवाहन	१२ दशरथ	२४-४-१२	७. भरियप		२. उत्तिसेनन
७१ विष्णुमोर्ख	१३ वीरसाल	३१-८-११	८. कुट्य		३. पांचुक्तनॄ
७२ महीपाल	१४ वीरसाल	४७-०-१४	९. मनमध		४. पांडुक्तिति
<hr/>					
७३ ऐंगार	१ वीरमहार	३५-१०-८	११. विष्णुराज		५. रत्नपालनॄ
७४ देवरथ	२ अभित्तिंद	२७-७-१८	१२. विंस		६. विष्णु
७५ दशापाल	३ सर्वदा	२८-३-१०	१३. विष्णुराज		७. द्रेसितिति
७६ विष्णु	४ विष्णुपति	१५-४-१०	१४. अलेपत		८. द्रेसितिति
७७ विष्णु	५ वीरसेन	२१-२-१३	१५. अलेपत	९. विष्णु	९. विष्णु
<hr/>					
विष्णुम् १५५१					

અધીક્ષાત્ર	૪૦-૮-૭	૧૬. પંચાલ	૬ ખનાં
જાતુપેષણ	૨૫-૪-૩	૧૭. પદુશ	૭૩. પેહસ
૧૦૪ કિલો	૮ ખંબરાલ	૧૭-૨-૧૦	૧૮ ગંગાપાલ
	૬ તેજપાલ	૨૮-૧૧-૧૦	૧૯ રતનપાલ
	૧૦ મહેષદેવ	૩૭-૭-૨૧	૨૦ ખનતપાલ
૧૦૫ અનંતપાલ	૧૧ કલમેની	૪૨-૪-૧૦	૨૧ રાધપાલ
	૧૨ કાર્યમદીન	૮-૧૧-૧૩	૨૨ સમરપાલ
૧૦૬ કોલરાજ	૧૩ જીવદેવ	૨૮-૬-૧૭	૨૩ રથપાલ
	૧૪ કલિરાય	૨૬-૧૦-૨૬	૨૪ હૈપાલ
૧૦૭ મહેસેન	૧૫ વિરેન(૨)	૩૪-૨-૧૦	૨૫ અમરપાલ
૧૦૮ અંધ્રાય	૧૬ આદિતેટું	૨૩-૧૧-૨૩	૨૬ લલેપાલ
અધ્યક્ષા	પરમાર્થશા	પરમાર્થશા	નાગનંદા
પ્રદુષદ્વાર-દીપદ્વા	ઈદ્રમરથ	ઉજ્જ્વલ	પાઠ્યપુત્ર
		૩૨ રામપાલ	૧. શુંગમિત્ર
		૩૩ નાયપાલ	૨. બુદ્ધમિત્ર
૧૦૯ અગ્રિષ્ટ	૩૪ ધરણીધર	૩૪ પુષુમાર	૪૨-૪-૨૪
		૨ મહિં	
	૩૫ ધીમણ		૪૨-૨-૨૬
૧૧૦ ઉપરેન	૩૬ ધીરેન	૩ મનરી	૫૦-૧૦-૧૮
		૪ મહાયુદ્ધ	૩૦-૩-૮ ૧ દેવલુતિ
	૩૭ લદ્ધમણ્ણોન	૫ હૃતનાથ	૨૮-૪-૨૫
૧૧૧ અનિદુ	૩૮ કામરોન	૬ જીવનરાજ	૪૫-૨-૫
	૩૯ ઉપુષ્પા	૭ દુરોન	૪૭-૪-૨૮ ૨ સહેલે
	૪૦ ઈદ્રસોન	૮ આરીલાલ	૫૨-૧૦-૮
	(કનકસોન)		
		૯ રાજપાલ	૩૬-૦-૦
૧૧૨ જાધીંહ	૪૧ શતુપેષ		૧૦ વાસુદેવ
૧૧૩ દ્વાપાળ			સુધેના
	(મહારી)		
૧૧૪ જાગેમલ્લ	૪૨ અર્જુન	૧. મહંતપાલ ૧-૧૪-૦	૪૨ સુર્દર્યન
			૪૩ શાતકલ્લ
૧૧૫ જાખરાજ	૪૩ વિક્રમાહિત્ય મહાનિકામ	૪૩-૦-૦	૪૪ શાલિવાહન
	પાદીપે		
૧. અનિ કાળિ, જાધીપત્રી અનલેણ્ય-પ્રવરતયઃ 'અનિના નથુ પુન થયા : ચદ્ર દાતાનેય અને દુરીસા, એમાં ચંદ્ર ક્ષત્રિય અને દુસ્તાનેય તથા દુર્વાસાને અદ્ધકર્મ સ્વીકારું', દુરીસા-દોત્ર યણાસારત-પ્રસંગ ચૂધીના સમય ખર્ચેંત પ્રસિદ્ધ રહ્યું છે. દુસ્તાનેયના નામથી તો કોણ અજાણું છે ! (આપણું)			
		૮ાનુભાગી/૧૬૬૧	પાદીપ

## વહોરાઓનો ઈતિહાસ\*

[એક હસ્તપત્ર]

ડૉ. અમ. લુ. કૃતેશી

શ્રી જી. જી. એ ફેની જેવા પ્રખર વિદ્ધાને મુંઅઈની સેન્ટ્રાલાઈસેરીની અરથી-દારસી હસ્તપત્રોનું એક ટેટેલેજ તૈયાર કરું છે એ તેમાં અરમા હસ્તપત્રોના “દ્વાદુર્દ-નગ્નુભુર્જ અહિરણ વિફિક્તિં અહોરતિલ બાહિરદ્વારા”નો ઉદ્વેષ કરી છે, અર્થાત् “શ્રીનાનિત વહોરાં પદના દોકાનો ઉન્નત્રણ અહોરાત.”

આ હસ્તપત્ર અરથીમાં છે; વચ્ચે કચાંક કચાંક ઓનો દારસી અતુવાન છે, કચાંક નથી. એના લાલિયાં નામ મુનીની ઢાળ સલાહુદીન અરાઈ છે. એના કાર્તોનું નામ મળતું નથી, પણ હસ્તપત્રની એ પોતાને વહોરા ડારના એક સંઘ તરીકે જોણાયે છે. તદુરાંત કાર્તોના માલમાં ને વહોરાઓના ખુલ્લર્ખ બર્મચુરુ હના તેમનું નામ મોદાના જેનુદીન હતું અને દેખાયે એમના નામ પછી “ખુલ્લા એમને રીતોધૂં અર્પો” એમ લખે છે. આ હસ્તપત્રીના રચનાનો સમય, જે કથાં ઉત્તીવિત નથી, તે ઉપર્યુક્ત વિગત ઉપરથી નક્કો થઈ શકે છે.

આ હસ્તપત્ર “મિરાતે સિક્કદી” નામની દારસી હસ્તપત્ર સાથે બંધાવેલ છે. “મિરાતે સિક્કદી” અને વહોરાઓના આ પ્રતિહાસનો લાલિયો એક જ છે. લાલિયો ઢાળ સલાહુદીન અરાઈ દ્વેણે કે “ફાર્મસ સાહેના આહેશી મેં હિ. સ. ૧૨૬૪-૪ સ. ૧૮૮૮ માં અમદાવાદના ઢાળ સાડેના, કાળ હુસેન વહું કાળ મોહન હંસ સાલેહ સાહેના અગનનાં પેસને ‘મિરાતે સિક્કદી’ની આ હસ્તપત્રની સંપૂર્ણ નકલ કરી. હિ. સ. ૧૨૬૫, સારુ મહિનાની સાતમી તારીખે લાલિયાંએ આ હસ્તપત્ર પૂરી કરી.” એટલે એક જ વર્ષમાં એથે આ અને હસ્તપત્રોની નકલ કરી.

આ ઉપરથી એમ કરી શકાય કે મજબૂર લાલિયો મજબૂર ઈતિહાસની એ જ વર્ષે અમદાવાદમાં જ નકલ કરી હોવી જોઈજો, અથવા ઈબારતની નકલ કરવાનાં લાલિયાંએ જોઈએ તેટલી ચેક્સાઈ રાખી નથી. આજે “બોડરા”નું અધુરયનું “અવાહિર” કરવાનાં આવે છે. આ હસ્તપત્રમાં એતું અધુરયનું “અહોરદ્વાર” કરવાનાં આવું છે. અર્થાત્ ભાષામાં અધુરયનું અને રીતે શક્ય છે, પણ હાલ “અવાહિર” વધારે પ્રયત્નિત છે. આ હસ્તપત્રના જરૂરી કષાયમાંનું યુભરાતી ભાષાંતર નાચે પ્રમાણે છે :

“સત્યના પણે ચાલતા, હિંદુમાં વસતા વહોરા નાને જોણાયાતો દોકાનો આ અહે રાખ છે, એ દોકાને કેવા છે, એમનું ભૂલ કર્યા છે અને એમને આ અધુરમાં લાલાવો-ચેટ્યે કે ઈસ્થાન બર્મ-ક્રી રીતે મધ્યો એને આમાં દોડા અહેવાલ છે. હું પોતે પણ એ પેક્ઝ એક છું. આ પંથના દેખાય બાબુ અને આત્મર દાખિયે સત્યના સાથે પણે ચાલનારા હોય છે. દમેશ નમાજ પઢે છે, રાન રાખે છે. ખ્યાલત હોઈ છે, (કિલાય (કુરાન) અને સુન્નત પ્રમાણે વર્તે છે, આ ખંનેના નિયમોનું કરી ઉત્થાન કરતા નથી અને એનો કોઈ પણ અંશ જરૂર કરતા નથી.

“જે દોણાં એક ‘હાદી’ જોઈદે કે બર્મચુરુ હોય છે, જે એમને હંમેશા સલામોની કરવા પ્રેરે છે અને અસ્ત્રય તથા પાપથી રોકે છે. વહોરાઓ એમના આદેશ અને નિયમને યુરતપણે વધુ ચાલ્ય છે, છું એમનો અનાદર કરતા નથી, જ્ઞાને કે ‘હાદી’ સાહેનું એમના ઉપર એક પ્રકારનું રાખ્ય ચાલે છે. એમની એક આચાર-સંહિતા છે, એક પરંપરા છે, વહોરાઓ એને અનુસરે છે.

“યાદો એક ‘હાદી’નું અવસાન ચાલ છે ત્યારે તરત થીલ ‘હાદી’ સાહેય નિયમ છે. એ સુંનતા અને શોભાતા પરાવતા હોય તો હાદી સર્વાંશના સંતાનમાંથી નિયમ છે અને જે એમના

सभा संभांधीको इतरां अविद्याती पात्रता धरावता होय तो ऐमना संतान सिवाय अन्यने पशु काढी जनावाय छे. एड वर्ष 'हाही' साहेबनी वर्षाथी थर्ट जय तो वहेरा लाईको. ऐमना आदेश भ्रामणे वर्तावा तत्पर होय छे अने ऐमनु आविष्ट त्सीकारी ले छे, सहेज पशु आताकानी हाँपौ वगर, आ ऐमने एड सिररतो छे.

"वहेरा लोडा ईस्ताम सिवायना धर्ममा आनला होता, पशु यमनथी अष्टुव्वाह नामना एड संत पुरुष अंकात पद्धारी, स्वल्पन अने पाप समे ऐमने खुदाउ गक्षण आम हुँ. वार्षी अने वर्तनभाँ जे संभूष्ण अनुकरण्यीय हुना.

"अंबार्मा काडा डेकाै अने ऐमनां पत्ती हाडी डेलीने अष्टुव्वाह साहेश ए वर्षते मल्हा के ज्यारे ऐझे चेताना ऐतरामा काम इतरां हाला. हाडा डेलाए पूज्युः 'आप डोष छो अने फ्रांची पद्धारी छोै' ऐमनु छ्युः 'हुँ अरपसानाथी आव्वो छुँ अने भारे पार्शी पौजुँ छो, काडाए छ्युः 'हुवो तो छे, पशु ऐनु पार्शी सुकाठ गजुँ छोै' ऐमनु छ्युः 'कर्ता छ जे हुवोै' ऐमने त्वां लाई ज्वामां आव्वा. ऐमनु पूज्युः तो ज्वो आ हुवो उत्कायर तो तमे तमारो धर्म त्यागी भारी धर्म अंगीकार हर्तोै? ऐमनु छ्युः 'होै' अष्टुव्वाह साहेजे ह्वामां तिर गार्हुँ, ए नीचेना पर्यारमा अहिने वाच्युँ अने हुवामां पार्शी जिज्ञाना भाइयुँ. हाडा डेलाउ अने ऐमनां पत्तीशी त्वांने त्वाै ज मुस्कामान थायो. त्वार पाद भोदा अष्टुव्वाह वर्तीना अंदराना लाग्नां गया. त्वां ऐमनु यमतकारी हैपाइया. एड विदान (महात) लेउ ऐमनी मुखाकात थई. भोदा अष्टुव्वाहे ऐव्वा असरकारक रक्षावात फीडे ऐमना मनने शांति भएना. ऐमनु पशु ईस्ताम अंगीकार क्यो.

"त्वार पाद ऐझो अंकात पद्धारी, त्वांना एड मंदिरमा लोढागो हाथी डाई पशु जलना डेका पशु छ्वामा लटक्को हुतो. ऐमनु जे धार्थाने चेतानी शक्तिशी निचे उतारें. आ यमतकारी लोडा अंगाया अने बध्या लोडाए भूतियोनी पूलाते भद्दै खुदानी क्लाहादत्तनो रसतो र्सीकारें.

"सिंकराम ऐसीन नामोनो त्वानो राजन आ वात सांकेतिको रस्तध थर्ट बयो. सिंकरामे छ्युः 'हेही शक्तिशी आदिकालको हुवामां अध्यर लटक्को भेद काकाय धार्थाने डाले पाउचोै?' लोडाए छ्युः, 'प्रभार्थी डोही संत पद्धारी छे, ए ऐमना धर्मनो प्रयार हरे छेै' राजने गुस्से थहिने ऐमने पकड्वा एड लश्कर गोइक्युः. ज्यारे लश्कर ऐमने पकड्वा गजुँ त्वारे ऐमनी आसपास एः मार्डा आडा भनी गयो, लेगो अगिनी ज्वालाओ हाली. लश्कर भाटे ए ज्वालामु असाक्ष छ्युँ. राजने भयर आपी, राजने आवाने निवांती फीडे आपानी पासे पहेचान्नो भार्ग फीडी. आपो आपछे थर्टी फीडो. जे आप अत्यपि थर्टी तो अमे आप्युँ अनुकरण फीडीै.' त्वारपाद अगिन क्यो पायो. त्वारपाद राजने छ्युः : 'हे संत पुरुष, अमारी धर्म ग्राचीन छे, तमारी वात अमने त्वाै लागे छे, तमारी पासे तमारा सत्य अने अमारा असत्यनो डोही पुरावो होय तो आपो.' संत पुरुषे छ्युः : 'हे राज, आप आ कथ्य अने भोदी भूर्तिने लज्जे छो, आ भूर्ति वार्षीकीत छे. आप अने जे पौकारी फो ते ए सांकेतिको शहती नर्थी. ए आपना दालालाल भाटे ज्वालादार नर्थी, पशु हुँ एड महाल खुदाने सज्जो छ्युँ छुँ, भने ज्वानाथी हुँभेद्य क्ल्यायुनी अपेक्षा छे, एना सिवाय डोहीया हुँ जर्तो नर्थी, ए हुमेह थुवतो रहेतार छे. हुँ ज्यारे पशु चोक्कुँ छुँ तो ए भने सांकेतिको अने ज्वाल आपे छे, ऐमु ज मने यमतकारिक शक्ति अपौँ छे, जे छम्बुँ तो तमारी आ भूर्तिने तमारी आधार्म ऐकाती फीडे थकुँ छुँ, ए पेते ज ऐवाने आपने फोरोः मारो पशु सत्यनो छे. जे आै मारो धर्म अंगीकार हर्तवानी आव्वी आपो तो आपानी आ भूर्तिने हुँ ज्वानारी छ्युँ'. राज ए भाटे सहजत

थयो. भूविंश्च ओलीने संतपुरुषना पक्षे साहो पूरी. राज अने ओमनी साथे आवेदा ओमना सहजर्मी-ओमे आ बहु 'सामज्य' अने ज्ञेयु. राजमे गोतानी ज्ञेयाई कापी नाखी अने ओमनी साथेना दोषाग्रे पथ् एवुं कठिवाय छे ते ए दिवसे ५४ग्रेवी ज्ञेयाईओतुं वजन लगभग २१० रत्न थयु.

"त्यार आह अंभातमा हर दूर स्थिर ईस्वामेनो द्वैदोवा थयो तेमज आधार युभरातमां पथ् "सिद्धराज लेशींग मुख्यमानृ थयो अने लारमल पथ्. सौभ्रथम मुख्यमान थनार ए ज हता, अमारा भौलाना अने डाकी सैदुक्षीन ओमना ज वंशज छे. ए ज ओमना यथस्ती पूर्वज छे. त्यार आह ओमना सुपुत्र भौला पाहुयना हाथामां सत्ता आवी. त्यारआह ओमना सुपुत्र मुख्य ईस्वाम थया, ओमयेहु ज ओमने उडेवी हता. त्यारआह शोडे समय सत्ता (गाडी) ओमना वंशजे अने सगाओतमा रही अने थोडा समय ओमना वंशजे सिवायना दोडा 'हाडी' अन्या, जेटदे सुनी के लालना अमारा शैदाना मौलाना सैदुक्षीन हाडी थया. खुदा ओमने क्षयामता सुधाई दीवावुष अगो. असे अमे सो ओमने अतुरसीच छाचे, वर्णनी आधार अमोशी ज अमारा भार्गदर्ढक छे.

"आ रीत गुजरातमां ईस्वामेनो उदय गोवा अपदुल्लाहना हाडी हि. स. ४३० मां थयो. अंभातमा ज ओमनी कळर छे. ओमोशी यमना भालिक अन मालिक हमावाना शाख हता. ओमेहो हिंगतुल्लाह भिन मूसा शीराजीना शाख हता. शीराजी सैदुक्षी ओमना यथस्ती पूर्वजे पासेवी गाल प्राप्त होसुं अने आ सिलसिला छेक हजरते सवामन हारसी (२. ६.) सुनी पडाये छे, जेमना विशेष रसेहुस्ताहे (स. अ. १.) हरमायुं के सवामन अगो 'अहले भात' देकी अेक छे."

मही अतुराव फूरा थाय छे. त्यार आह कातप्रामां कळरत सवामान हारसी (२.६.) वी प्रकाशाना अके ए इक्करा छे. ए वातनो लेकं हाल आ लेखने संबंध नया.

अंते लेखक कळे के "भराह-वेचार्यु" करनारेन ओटेके ते वेपार करनारेन युभरातना दोडा 'वडोरा' कळे छे. वडोरा हुऱेवावया माटे बीलं पथ् कारण्यो छे, पथ् सोवा जायुतु अन सुचिहेत झारसु तो आ ज छे."

आ हस्तप्रती वडोरायो. अंते प्रयत्नित वार्ताओने टेका आंपडे छे. तदुपरांत ओमना 'हाडी' विशेष शेडु न लाश्यवातु अगे छे.

अंभातमां आवेद हाई ओमाई अपदुल्लाहनी।<sup>१</sup> हजर उपरना देखमां मुख्यतातिरा आदेशया ओमो अडी आव्या हेवातुं वर्ष्यु छे. मुख्यनलिर यमनने राजना हता. ओमा धृताहलन वगता ए-ओक अरसी हस्तप्रता मुख्यक्षेत्रामा सेन्ट्रल लांडिंग्रेसीमा छे, जे वाच्या यक्षाई नया, क्षाय ओमा अव्यासथा वधु वित्तो प्रकाशमां आव्या. अ लेखमां अतिरिक्तियानो पृष्ठ उत्तिष्ठ छे. आवाइकाना हंतरना देशाने मुख्यमाना सामूहक रीत 'मगरांते' तराके आगेपे छे, जेमा अवाकेरियानो सामावय थाव ए अने 'मगरिमा' भेदाच शास्त्र वधार प्रयत्नित जेवा भगे छ, पथ् अ ए हस्तप्रता जेवा पक्षी आगण वात करी चाकाय.

#### पादी५

(१) भूज अस्ती हस्तप्रतमां आ ज प्रमाणु छे, पथ् ओती नाचे लभेदा हेरसी अतुरावाना ओटेके वधारा करवाना आव्यो छे के इवातु पायाया फूरु हतु त अपदुल्लाह साईमे मीढु की भतायु.

(२) आ अवा ज प्रसंगो करीम महामह मास्तर 'महागुजरातना मुख्यमाना'ना वर्ष्याव्या छे. शुम्मो ५. १३५-१३६, पथ् कोई प्रमाणु आयुं नया. ओमेहो मान ओटु ज वर्ष्यु छे के "सिवा-ओनी दह मान्यता पथ् छेक अकारण्ये तो ना ज होय."

(३) थी करीम महामह मास्तरे काका चेक्का अन काकी ओक्की ओम नाम आधार छे. (महागुजरातना मुख्यमाना पृष्ठ. १३६)

भूषि

लान्युआद/१६६१

११

(४) एक शार्दूलीनुं नाम मोहमदवी हुं अम भास्तर वधे छ. पृ. १३३, 'आपे डासर' नामना अंथना लेख कर्ता शेख मोहम्मद छक्रमे अमनुं नाम मोहम्मद आप्युं छ. (आपे डासर, थीज आश्रिति, पृ. ३६५-३७०)

(५) भूग अरथा हस्तप्रतमा 'सिद्धर जेशींग' लभ्युं छ तेथी विद्वान डेटेक्टोर-लेखकशी इच्छी साहेब अने 'सरदार जेशींग' वाच्ये छ (लुग्गा डेटेक्टोर, पृ. ८), पर्य भारा नम्र अभिमाय मुज्ज्य अने सिद्धाराज' वाच्युं लेठेगे.

(६) शेख मुहम्मद छक्रमन भास्तव्य प्रभाष्ये दाई भा अपदुख्लाल अथवा मुहम्मदे २० वर्ष मुख्य आलय तरीके सिद्धराजना स्वेच्छाया तरीके काम कुर्या हुं. अने युस रीते ईस्वामनो प्रयार क्षेत्री, सिद्धराजने लाय थां अमने अवता संगमानी देवानो आदेश अपायो, पर्य पड़ताय अ पहेला ज्ञ अंग्गा अवसान पाभ्या अने अमनी लाश छुटोने दगदो अनी गर्द। (आपे डासर, पृ. ३७०) छक्रम आहेल अम पर्य क्षेत्रे छे के डेटेक्टाळ लेहोना भास्तव्य प्रभाष्ये सिद्धराज मुस्लिमान ता थेयो, पर्य पाच्यांयी अ हिंदू थष्ट गयो हुतो. अमेलु अंने वातो त्रिसे डाई लावांने आप्यो नव्यी.

(७) शेख हस्तमना डेटो प्रभाष्ये सिद्धराजना भास्तमव अते ताउमव नामना अे प्रधानो मुस्लिमान अयो. हीन महम्मद भास्तर भास्तमने डाई सांभात माने छे, डेटो भास्तम नामनो सिद्धराजनो काई प्रधान होतो नव्यी. आ भास्तमनी क्षमर ऐडा विक्ष्वाना उमरेठ ग्रामां विद्या वडोराज्ज्ञा ताप्तस्तानां ढोवातुं क्षेत्राय छे, भास्तम अटक्का वडोराज्ज्ञा सौराष्ट्रां जूना राज्योन्नां छे.

(८) मोलाई अपदुख्लाल साईंगनी क्षयर अ भास्तमा छे, अमनी क्षयर उपर अरण्यांते एक क्षतमे छे. आ क्षतमानो होटो भने डो. रामज्ञाई सावित्रियो(भो.अ.) विद्याभवत) आप्यो. त्यार आद अमे डेटेक्टाळ अनो अभात अर्थी लेई पर्य आव्याय. आ क्षतमाना अरथा लभायुं तो क्षावार्थ आ प्रभाष्ये छे :

"आ क्षयर पवित्र हृष्ट मोलाई अपदुख्लालनी छे, जे मुस्लिमानिरना हुक्मांसी सौ प्रधम अडी धर्म-प्रधारार्थे पक्षार्थी, अमेलु अलविद्याना दाईने अहेका आप्यो. अमना प्रधनोने लाघ अने अमना सायी मोलाई अहम्मदना प्रधनोने कारणी, युद्धां लिंग्ना २/३ नेटला लेहोने भार्यार्द्दीन अपायुं. अंने सिद्धराज जेशींगना सभयाना अडी पक्षार्थी. सिद्धराजे अमनी वात त्याकारी अने मुस्लिमान अयो. आ धटना छ. स. ४४५ अथवा ४४७ थी हिं.स. ५३६ वर्षाचेनी छे. अंग्गां शेहरमना पहेला हिंदूसे मरण्यु पाभ्या." भूग हस्तप्रतमा हिं.स. ४५० छे, ज्यारे क्षतमाना हिं.स. ४४५/ छ. स. १०७२ छे. आ काई मोटा तदृशवत नव्यी.

(९) हजार धीर अहम्मदशाही लालांप्रीमा 'अबमुग्नी' नामनी एक अरण्यी हस्तप्रत छे. अना लेख भगविभात विद्वान मोलाना महम्मद ताहिर पर्यणी (भालु ८८८ डि.स.) छे. अमा अंग्गा तोताने 'वडोरा अर्टले के अताजिरुल लिन्दी' अथात 'वडोरा अर्टले के आतातीय वेपारी' तरीके शोणापावे छे. जोलाना मुहम्मद ताहिर युत चुनी हता अते अहम्मदरोन साथ लष्ट अमेलु विद्या विशेष चण्णवण हृतेला. उपरे आआ जती वधते उल्लेनां अमने शहीद करवानां आव्या.

(१०) मोलाई अपदुख्लालना डापे सिद्धराज मुस्लिमान अयो, पर्य शेख छक्रम लष्टे छे के एतुं क्षेत्रां अवे छे के सिद्धराजतुं मरण्य थयुं तो युस रीते अने दृश्य अने जेतुं नहेर करवाना आव्युं के हेती देवतांगो अनी लावाने लष्ट गया. 'आपे डासर'मा' शेख छक्रमे अमे छहेला माटे हृतेला आप्यो नव्यी.

[नोंदः [सिद्धराज विशेनी आ वात समालीन साडित्यां क्षयां भगती नव्यी -तंत्री]

# પારડી તાલુકાના આહિવાસીઓનાં દેવ-હેવીઓ

ડા. લ. જે. દેસાઈ અને ગ્રા. બી. ચેન. લોઠી

[આ અવ્યાસમાં પારડી તાલુકામાં વસતા આહિવાસીઓનાં દેવ-હેવીઓ વિશે જ માહિતી એકન ફરજામાં આવી છે, તેથા એ સમાજની ઉત્પત્તિ, એમના પૂર્વનેનો ઈતિહાસ, આર્થિક સામાજિક અને રાજ્યાધ્ય વાયરો વિશે ખાસ માહૃતી આવામાં આવી નથી. આહિવાસીઓ પૈકી એહો થોડિયા જાતિના છે તેઓનાં ૧૪૪ કું માનવામાં આવે છે.]

આ દેખાની સામનો માટે આહિવાસી વસ્તીવાળાનાં નાના મોટ્ટો ૧૬ ગામોની મુખાકાત દેવામાં આવી હતી તેમજ એ સમાજનાં આગોના ઝી-પુરોણો પાસેથી એમના દેવ-હેવીઓ વિશે માહિતી મેળવવામાં આવી હતી. પારડી તાલુકાનાં ૮૨ ગામો હેડો ને ગામોની મુખાકાત દેવામાં આવી તેઓનાં નામ નાચે પ્રમાણે છે :

૧. પરવાસા	૬. તરમાલિયા	૧૧. પારડી
૨. કુમલાવ	૭. આમણી	૧૨. નાની તાંધાણી
૩. બાલદા	૮. પેરવાલ	૧૩. કિકરલા
૪. રાહિશ્યા	૯. શાયદી	૧૪. ખલીઠા
૫. પરિયા	૧૦. વાખણીયા	૧૫. પણવાય
		૧૬. સુપેદ

થોડિયા જાતિ : આ આહિવાસીઓ પોતાની ઉત્પત્તિ વિશે ડેટવીક પ્રયત્નિત લોકદ્વારા વર્ણિંદે તે મુજબ પોતાની જાતિને એહો ૧૫૦૦ થા ૨૦૦૦ વર્ષીની પ્રાચીન માને છે અને રાજ્યપૂર્વ ગ્રાસિયા વંશમાંથી એમના પૂર્વને જીતરી આવ્યા હતા એવી માન્યતા ધરાવે છે. ૨. મહારાષ્ટ્રના ધૂળિયા જિજ્ઞાસા જંગલ-વિસ્તારમાં પોતાના પૂર્વનેએ સૌ-પ્રયત્ન વસાહત સ્થાપી હોવાથી એહો "ધૂળિયા" હેવાયા એવો ભત પણ પ્રયત્નિત છે. ૩. થોડિયા સમાજની ડોઝ પેટા જાતિએ નથી, પરંતુ જુદી જુદા કુટો છે. એ. એ. જ કુટોમાં લગ્ન કરવાનો નિષેધ માનવામાં આવે છે. આ કુટોનાં નામો પરથી નાખુંબા મળે છે કે આ લોડો પોતાની જાતિમાં પણ ઉભ્ય-નીચ જેવા વર્ષનેદ પાડે છે.

રઘુનાથ દરઘનાન ક્ષણાનું છે કે આ સમાજની જે દેવ-હેવીઓની પૂજા યાય છે તે બધાં દેવ-હેવીઓનાં સ્થાનન્દે કોઈ મંદિરમાં જ હોય એનું નથી, સામાન્ય રીતે આમના પાદરે લીમાં પીપળા વડ મહૂડો આમલી સીસમાં કે સાયણાના દૃષ્ટિ નાચે સ્થાનન્દે હોય છે. આ દેવ-હેવીઓની સૂતોં કે આધાર પણ સ્થાનિક રહેનારા કુંભાર કે સુધારે આદી કે લાક્ષમાંથી જાનવેલ મનુષ્યના જેણી સુખાકૃતિ હોય છે અથવા આરીના કદા પર નાના નાના આગામીથી આજ પાડેલા હોય કે લાક્ષમાંથી આંનાનો આધાર પાડેલા હોય છે. ધલી જગ્યાએ નાત્ર કુંભરી સુખાકૃત પદ્ધર કે લાક્ષના દુંડો પર સીદ્ધ લગ્નાં પૂજા માટે સૂર્યાં જીની કરી દેવાના આવે છે. દીવો પૂજાનું સુખ્ય સાધન છે. નોંધે કે જોગના પાણી અફરાં થા મરદાનું આસ અને હાંડ હોય છે. આ પ્રાણ મેટે જાને હરેક દેવ-હેવાને અંબાકુલાથી જ માનતી હોય છે. હરેક દેવ-હેવીમાં અગ્રય શરીરને એંબોના અરથી જ્વાની, કદરપા કરી દેવાની, ખીમાર પારી દેવાની, ખારેલા કાયેનાં આખાદ્ય અનવાની, ખાળકો ન થવા દેવાની, અળમા જેગું હોયું અનાખ લઈ જવાની અને પેતરોનાં પાઠ નાશ કરવાની વગેરે શક્તિ રહેલી હોવાનું મનાય છે, તેથી એવાં દેવ-હેવીઓની ખીક આહિવાસીઓનાં ધર કરી ગયેલી હોય છે. આ પ્રકારનાં ડ્ર. અને

અનુભૂતિ

જાન્યુઆરી/૧૯૯૧

आधर्मकोने क्षरणे ज आ सोडा अनेक जगता पहेजेतुं क्षमेहरथान भनी गया हो. डाई पथ शैग-  
याणो उ आपत्ति रोक्ता देवानी बाधा दे छे. आ कार्य हेव-हेवाना हृत तरीके भगत-भगताथी करे  
छे. भगत के भगताथीतुं क्षम करनार वर्ग एमनी जलिनां ज भाषुस ढेप हो. जेओ दुःख नवडावे,  
दुःख उपर इन (आग) लगाउ, मातानो लार काढे तथा पेतानां पशुओ आटे बाधा दे छे. एमो  
पाडो बुझदौ. के भरवो भवि तरीके अगवे हो. आम भनुप्प अने पशु अनेनी आपत्ति हूर क्रवा बाधा  
(मानता) साधवामां आवे छे.

भगता परंपराजत स्वरूपम एमेनी वारसागत शक्ति एमेना अपरिवर्तित भूत अने प्रतीकोंतुं  
सातुं उदाहरण छे. ४ स्थणतपास दारा कैलांक मुख्य अने प्रसंगेचित हेव-हेवाणोना रथानका  
पूजानिधि भान्यता वज्रेनी भाषिती भेगवतामां आवी ने निये मुकुला छे :

(१) घरेमठेव (अहोदेव) : अहा तरीके पूजाना आ देवतुं स्थान पीपणा सीमेनो हे सीसमना  
जाइ निये होय छे. एतुं मुख्य भवित खारी आभासा राख्यू धोरी भार्या उपर आभवतदार क्षेत्री  
पासे आवेलुं छे. ए उपरांत तालुकामां भीलां वे जायीता मंदिर छेः एक यगवाड गाममां अने  
भालुं खालीदा गाममां आकीना नानां नानां भोक्तर वत्रहुं स्थानहो आआ तालुकामां ४० थी ५०  
नेटवां छे. आ देवनी अगवती बाधाओ भानताओ पूजानिधि वज्रे भाटे पारहीना भहिरे आआ  
तालुकाना आदावासी भ्रम आवे छे.

आसो वह आरसने देवते आ देवनी पूजा थाय छे, भेला भराय छे, लीची बाधाओ  
(भानताओ) मुकुल छ अन वीज बाधाओ देवाय छे. आस क्षीने जोनाणिया आ देवने सावरोप  
माने छे. बगड गाय जे सना शी जगाने गेतु लगाउ छे, भवित नाजेव-सी हूर-योआ दूस वज्रे  
यावे छे. हालमा कैलांक भान्दारोमा आ मुर्त गुह्ला जायाय छे, परंतु हूरना ज गवापस्तानर्न  
गामाना गाईना आदृत भयाव लाङामाया भानावष अलहेवना पूज थाय छे.

(२) सलाभाई (बालभाई) के शीतणा देवी : आ देवीं मुख्य मांदर ववसाइ जिव्वाना  
ववसाइ तालुकाना मुग्ग जान आपत्तु छ. भालुं मांदर पारडी तालुकाना यगवाड गाम आवेलुं  
छे. आ देवाना उन्नताना आपत्तु द्वांते साताना देवते थाय छ. शाक्षु शजरात युनेवांटीना  
संस्था 'संस्कर द्वार देवायव रटीज' तरक्षया 'देवा आदेवन' नामनुं पुस्तक भगवत थुं छ, जेना  
लम्भ आप लाई भएन सन १६२० न नवभरसमा सुरत जिव्वाना आदावासीओना 'देवा आदेवन'  
नामया भगवेनी सामूहित येतानातुं पर्थन कुरुं छ. गायामुखमा आदिवासीओमां खार्म क मान्यताओ  
साथ राजकाय जग्याउ अन अनन्त, गहायाला भगवत्तु आ पुरतकां पर्थन करवाना आनुं छ.  
ऐपड हाई मनना भत असुसार आ देवा सलाभाई तराके लायीती अना हता. ए भूग याथा  
जिव्वाना पालवर ववसानाया आवी द्वांते अन त्याया वापी दम्भु पारडी धरवधुर वांसदा उनाई  
सालगड यईन व्यास द्वांते लायीती अना हता. पूजा मा हाई भगवत लाये छे उ सलाभाई हेवी शीतणानी  
देवा तराई उद्देवा। नामान पारडी रिस्ताना आदावासीमो वासते सनाजस्त्रवरथा अगेतु परिया  
अनी तथा आपु अगमा दुक्कु भाटे भूत-राहस्य-डाक्षावदा जेवा भान्यता उपरना कुम्हा तरीक  
माप थुं... आप आलु भास्तोली तथा ज्वावपार तालुकामां गावाकावेना सावीहार तरोड राष्ट्रम  
गर्वमा चहायक अनी.।

आ देवा हालमां शीतणा देवी तरीके अने अगिया देव (आपा) तरोड अने नामी पूजा  
छ. देवाना पूजा जे देवते थाय ते दिवसे पाँचवा जिसनुं राधेलुं दाहुं आवनो रेवार छे.

શ્વરામાઠ અથવા શીતળામાતાની માર્ગીની સૂર્તિ બનાવવામાં આવે છે તેના પર રીડોરના વેલા ચ્યાવવામાં આવે છે. ડેવલાંડ લીમાડાની પાન પણ ચરાવે છે, કારણ કે આજને કબારે શીતળા આવે છે ત્યારે રીડોરનો રુસ અને લીમાડાની પાનનો ઉપયોગ કરવામાં આવે છે. અણિયા ભાપા નથી લય એટલે શરીર ઉપર હળવર લાગવામાં આવે છે. દેવીની અનેક ભાવા રાખવામાં આવે છે. ભાવા મુહૂરા લેડા મંહિર જાપ છે તાં નેવેદાં કોરે કાગળ, ભૂરો (વાડળા) દોરો, હળવરનો ગ્રાંડિયે, નાળિયેર તથા કંકું ચ્યાવે છે, ખાત ખાન (સાત પ્રકારનું અનાંજ) સરણ રીડોરનાં આદુ વજેરે પણ ચ્યાવવામાં આવે છે. આ રૈખનો જોગ અનનાર ભાળક કે મોટી ઊંમરની ઘેરિની લાનો જરા પણ ઉપયોગ કરતી નથી. ભાગત ભગતાણી પસે શીતળાના દશા નેવડાવવામાં આવે છે અને એમની સ્ફુરણ મુખ્ય ભાવા રાખવામાં આવે છે. જરૂર જથ્યાય તો મરબાનો અલિ પણ યડાવે છે.

(૩) ભાયાહેવી : આ દેવીનું મુખ્ય મંહિર ધરમપુર તાલુકામાં વિરવલ ગામમાં છે. એના મુખ્ય પૂલરી (ભગત) હિતિયા ભાપા એક કુદુ આદિવાસી હતા. આ હિતિયા ભાપા પણ ભાયાહેવીને રીજિવા માટેના ભાગમધર્મે પૂલતા હતા હૃદિથી આદિવાસીઓ પ્રથમ પૂલ દર્શન વજેરે હિતિયા ભાપાના સ્થાનકાળી કરે છે, ત્યારથી ભાયાહેવીને પૂલ છે. પારી તાલુકામાં ભાયાહેવીની નાના મોટાં આવે રો ૨૦ નેટલો મંહિર છે તેમાં પરવાસા ગામના મુખ્ય મંહિર છે. ભાયાહેવીનાં મંહિરોમાં રામલદ્ધમણી-સીતા અને કલુનાનજની સૂર્તિઓ હોય છે. આ પ્રફલની સૂર્તિવાળાં મંહિરોનાં સ્થાનકાળે 'ભાયાહેવી' શા માટે કહેવામાં આવે છે એની ઢેઈને માહિની નથી. આ દેવીની પૂલ કાંતિક સુદિ અગિયારસ તથા રામનવમી(ચૈત્ર સુદિ નેમ)ને દિવસે ભાષ થાપ છે. આ દિવસે દરમાન મેળો ભરાય છે અને નેવેદ ધરાવાય છે. પહેલા નેવેદાં ભરવાનો બધિ ચ્યાવવામાં આવતો, પણ રહે શોડા મંહિરમાં નાળિયેર ચયાવે છે અને વેર જઈને ભરવો વધેરે છે. મેળા દરમાન રામાયણ ભાગવત અને નાની મોટી કથાઓમાં 'આગેનન કરવામાં આવે છે.

(૪) પાલરહેવી : આ દેવીનાં સ્થાન દરેક ગામમાં એક કરતાં વહુ જગ્યાએ એક જ ગામમાં હોય છે. આ દેવીનું મંહિર નથી, પરંતુ પદ્ધર કે લાલદારથી દેલી અનાંજને દરેક ગામને પાદરે પહરાવેલ હોય છે. આ દેવી ગામના રક્ષક તરીકે હોય છે. ગામમાં દુશ્મન ન આવે. રોગાણો ન આવે કે કુરુરતી આદ્દોન આવે એ સ્તુટે આ દેવી પૂલાય છે. એના પૂલ નેવેદ વજરેનો વિધિ કાંઈ પણ સારા દિવસે થાપ છે, ગામના કોઈ પણ સાચ્છિક કાર્ય વખતે પાદરહેવીને પૂલવામાં આવે છે.

આ દેવીયી જ્યારે ગામનું રક્ષણ ન થાપ અને કાઈક ભય-કર રેખ ગામમાં કાયુ પડી લય તો એક વિશ્વિષ પ્રકારને વિધિ ભાવ દેવાને રીતાવાના થાપ છે. એ છે 'દેવીનો ભાર ઉતારવો' આ વિધિમાં દેવીની પ્રતીકાત્મક સૂર્તિ ભાની કેને લાલદારના રથમાં સ્થાપનામાં આવે છે, કેને 'દેવીને રથ' કહેવામાં આવે છે. ગામના અથા લોડા પોતાના વાજિંગ્રો લઈને બેગા થાપ, દરેક પોતાને બેરથી અનાજ મરણું બદ્દું ઇળ નાળિયેર વજેરે જમે તે એક-એ વરણું સથે લઈને આવે અને ગામના મુખ્ય મર્ગેથા સ્લી-પુરુષ-ભાગડો નાચતાં ક્રદાના, વાનિંગ્રો વગાડતાં દેવીના રથને લઈને ગામથી દૂર નકી કે કોતર સુધી લાપ, ત્યા એ કાઈ સાથે લાયાં હોય તે દેવીને બધિ તરીકે ચયાવે, રોઈ જાતાવે, અને સાથે જેસિને જરો. દેવીના રથને તાં જ મુકી આવે, પણ વેર પાછા લાપ, આજ દેવીનો રથ

ખંખિક

જાનસુધારી/૧૬૬૧

: ૧૫

(५) ऐतरपाणि (नागहेव) : आ देवतुं स्थान दैक श्रवित्वासी रोटाना ऐतरमा शिखुं करे छे. मारीना नाना नाना कोई पथ प्रकारना आकारे. अनावी एने शुद्धग सीसम के अन्य अनाव थाप से शुद्धवामां आवे छे. श्रावण सुनि पाथमने दिव्ये ऐतरपाणी 'नागहेव' तरीके पूल करवामा आवे छे. आ देव ऐतरना रथेवान तरीके होय छे. ए ऐतरमा पठेवा ज्ञव ज्ञतुं उंद्र वर्जे रे आधुजीनो चिक्कर करी घेतुन्तुं वावेलुं अनाज अवावे छे. हर वरसे प्रथम परसाह थाय त्यारे अने रोपणी तथा वावेलीना समये ऐतरपाणीना स्थानके चोआ रांधवामां आवे, ताणियेर-सींदूरथी जेनी पूल करवामां आवे, पठी ज ऐतीना काम थर थाय छे.

(६) कुषुसरी (कुनहेनी) देवी : आ देवीनी पूल ऐतीमां वधु अनाज जिगे ए माटे थाय छे. देवीतुं स्थान आहिवासीजो चोत-पेताना ऐतरमा राष्ट्रे छे, अनाजना दोटमाथी नाना-मोटा आकारनी भूर्तीजो अनावी भगानां पधरावे छे. अनाजनां कुषुसरी के हुँदा परयी 'कुषुसरी' शब्द अन्यो छे. ऐतरमां पाइ तोयार थाय एटवे अगते ऐवानोने आजला वर्णी फनहेनी देवीतुं विसर्जन करी नवी भूर्तीजो पधरावे छे. ए वर्जते भरघानो भवि यावे छे. जेत्का प्रकारतुं अनाज पाइतुं होय ते अचमाथी शेडुं शेडुं लक्ष्मे ऐतरमा ज राष्ट्रे छे अने संगविकाहाजीने ऐवानोने जमख अपे छे. आ देवीनी स्थापना अग्नीनी पासे थाया पठी अग्नीनी ज्वानो शुभ्य भार्ग होय ते भार्ग पर नग्नहमां आवाना जाः साथे वास्तुं देवेऽप्य वावेवामां आवे छे. होराजनी वर्जे मारीनो वडो अंधवामां आवे छे. अमों सतत वान (सतत प्रकारतुं अनाज) अने उपर नाजियेर भुक्तवामां आवे छे. रसा पर राख्यी नष्ट पहा पाइ छे, जेठी भूत-पवित्र-गङ्ग्य वर्जे राजे आवोने पाइतुं अनाज जरभी न थाय. कुषुसरी देवी ऐतीना पाइतुं रक्षण करे छे तेवी खूब अङ्गापूर्वक जेनी पूल थाय छे.

(७) वापों देव (भाग्नावेना देव) : आ देवतुं शुभ्य स्थान पारडी गामना पारडी डोकेक खासे अगेलुं छे. भीलां नाना मोटा स्थानो आकारे १. था ७ जेत्कां छे. पारडीना देव समय तालुकामां प्रभ्यात छे. दैक रविवार अने शुद्धवारे आ स्थाने असंप्य शक्ताणु लेडो आवो छे. जे झाने आग्नेना ज्वन पठी आपों मरी ज्वान होय, भीलां कारोबार आग्नेनो ज्वन थावे न होय तो आ देवीनी वापा राख्यामां आवे छे. ए उपरांत त्वी के आग्नेन नग्नराई ज्वन, अमना उपर झेई भूत-पवित्र के ज्वानी नवर फडे, सभत मानगी अने के शरीरनो विकास न थाय त्यारे पथ आ देवीनी वापा राख्यामां आवे छे. आ देवना स्थानके अगत अथवा अगतस्थी ऐसे छे. ए दृश्ये हुख्यावे, दाढ्या आपे अने वनस्पतिनी द्वा आपे. आ देव प्रत्ये आहिवासीजो सिवायना सेषों पथ अक्ष राखे छे, जेता पूलविलिना नियमेनुं वालन भरे छे.

(८) हुमानहेव : आ देवतुं स्थान आयावेना(राम-दक्षमध्य-सीता)ना भांदिस्नी साथे होय छे, परंतु ए सिवाय लगक्कग दैक गामभामां हुमानहेवनी भूर्ती होय छे. तालुकामां आकारे १५ था वधु. हुमानहेवनो स्थानके तेमां पारडी गामभामां हुँ गरी दृणिया आते मोटा हुमानहेवतुं भंडिर टेक्की उपर आवेलुं छे. हुमान-ज्यती वर्जते तेमन दर शनिवारे लेडो हुमानहेवने तेल अज अने सीद्ध वडावे छे तथा नजियेर वधेरे छे. डेट्कांग गामेभामां पद्धयना आकार वगरना देवीनी स्थापना पथ लेडोबे डेली छे. आस करीने भीलां देव-हेतोजानी आधा मानता के पूजनियि पठी पथु हुँ अ ६९ न मेर त्यारे अगत अने आध्यम अनावी हुमानहेवने रोजवा जेनी आधा राख्यामां आवे छे. हुमानहेव आहिवासीजो स्थान केव ग्रन्थाय छे.

### प्रसंगाचित हेव-देवीओः

१. ऐप्राप्तीभाता॑ः आ मातानु॑ मुख्य मंदिर पारडी गःभमा॒ नगर पंचायत पासे छे. आआ॒ तातुकाना॑ लोडो॑ अही॑ दर्शन करवा आवे छे. आ देव उथरेक्ष-यरही॑ दूर करे छे. एनी॑ आधा॑ केवाथी॑ गमे॑ तेटका॑ मोटी॑ ज्ञानस॑ होय॑ तोपछु॑ दूर थर्थ॑ नय॑ छे. एती॑ भान्येता॑ दुछे॑. वर्षमां॑ गमे॑ त्यार॑ एनी॑ पूजा॑ याप॑ छे. गैशाम॑ सुह॑ तीज॑ (अभागीज॑)ना॑ हिसे॑ अही॑ भेगा॑ भराय॑ छे.

२. इष्टियु॑ देव॑ : पशुओमां॑ रोग न आवे॑ एना॑ आ॑ आस॑ देर॑ छे. आ॑ देनु॑ आठ॑ निक्षिन॑ स्थान नथी॑. पशुपालन तथा॑ ऐती॑ करनार॑ ऐप्तो॑ आ॑ देवने॑ माने॑ छे. बणहो॑ नाय॑ पडेराची॑ प्रथम वार॑ ऐतीना॑ कामां॑ लेवानी॑ शब्दात याप॑ त्यार॑ आ॑ देवी॑ पूजा॑ याप॑ छे. ऐतीमां॑ काम॑ आपातां॑ पशुओने॑ रोगयाणा॑ लाय॑ पडे॑ के॑ एनी॑ भरी॑ जल्ता॑ होय॑ त्यार॑ एनी॑ आधा॑ राख्यामां॑ आवे॑ लुँ॑ पुरुणे॑. आधा॑ राख्य॑ त्यार॑ वाण-भूच॑ क्षपाय॑ छे॑ अने॑ भाष्यावाना॑ भूम्यामा॑ (भरेली॑ भाड्ही॑) भावामां॑ आवे॑ छे.

३. भेवलो॑ देव॑ (जणहेवी॑)॑ः आ॑ देवी॑ मुख्य स्थानक॑ पारडी॑ गाममां॑ मुख्य अन्नरमां॑ जिलावाला॑ यो-कनी॑ पासे॑ छे. अ॑ उपरात॑ नाना॑-मैदा॑ स्थानक॑ आशरे॑ ८ था॑ १० लेटका॑ छे. जणहेवी॑ तराक॑ देवीना॑ स्वरूपमां॑ अने॑ भेवलो॑ देवना॑ स्वरूपमां॑ एती॑ पूजा॑ याप॑ छे. आ॑ देवने॑ आस॑ झीने॑ दुकाण॑ पडे॑, वरसाद॑ अनियमित अने॑ त्यार॑ पूज्यमां॑ आवे॑ छे. एनी॑ पञ्च॑ आधा॑ राख्यामां॑ आवे॑ छे. लेड॑ वह॑ अजियारसने॑ हिसे॑ नाजियेर॑ सीदूर॑ अने॑ दुकोती॑ एनी॑ पूजा॑ करवाचामां॑ आवे॑ छे. ज्यार॑ वरसाद॑ अलिकुव॑ न पडे॑ त्यार॑ लाकडाना॑ पाटका॑ उपर॑ मेहुला॑ देवीनी॑ भाटीनो॑ भूर्ति॑ स्थापी॑ गाममां॑ इखवामां॑ आवे॑ छे. आ॑ पाटको॑ जी॑ अकोने॑ यावनार॑ खीमेनां॑ मार्यां॑ पर॑ पाण्य॑ रेखानो॑ रिवाज॑ के॑ भेहुलाने॑ नवडानी॑, एनी॑ आराधना॑ झी॑ रीजवाची॑ परसाद॑ पडे॑ छे॑ एनी॑ भान्यता॑ आदिवासीमा॑ वरसने॑ छे॑, आ॑ प्रसंग॑ वरसादाना॑ लोकोनेत पञ्च॑ गवाय॑ छे. दा.त. 'केतर॑ वरहो॑ द्वितीय॑ वरहो॑-त्यार॑ द्वितीय॑ भेवला॑'

४. सातमुभी॑ भाता॑ः आ॑ देव-देवीओाँ॑ स्थान॑ भोट॑ लागे॑ दैड॑ आहिवासी॑ भेवला॑ वरसमा॑ राखे॑ छे. वरना॑ पूजास्थानगां॑ नानु॑ वेहिं॑ भानवी॑ एमो॑ चान॑ देवीओाँ॑ भूर्तिवाणु॑ चिन॑ भूडै॑ छे. आ॑ सात॑ देवीओा॑ आ॑ छे॑: १. अगारी॑ भाता॑, २. अंचा॑ भाता॑, ३. महाकाळी॑ भाता॑ (भरी॑ भाता॑), ४. अग्नानी॑ भाता॑, ५. अंडेश्वरी॑ भाता॑, ६. महालक्ष्मी॑ भाता॑, ७. भेवदी॑ (लेगयु॑) देवी॑.

आ॑ पक्षनिर्थी॑ सात॑ देवीओाँ॑ एक॑ ज॑ स्थान॑ सुनातु॑ क्षारधू॑ ए॑ छे॑ के॑ आ॑ दैड॑ देवी॑ मुण॑ लोगालेक॑ स्थान॑ वरसाद॑ जिल्हावानी॑ नथी॑ अने॑ दूर॑ दूरनो॑ देवीना॑ स्थानांडो॑ नियमित॑ नार्थ॑ यक्षम॑ नहि॑ तेथा॑ लेडा॑ समझुभी॑ चिन॑ क॑ अगो॑ उपसादानो॑ पूजा॑-दर्शन॑ भाट॑ वरसमां॑ राखे॑ छे.

उपसंहार॑ः पारडी॑ तातुकाना॑ गामोमां॑ स्थानतपास॑ करां॑ जल्हायु॑ छे॑ के॑ आहिवासी॑ प्रथमित॑ देव-देवीओा॑. उपरात॑ अणी॑ अनेक॑ नाना॑ भोटा॑ देवीना॑ पूजा॑ अही॑नी॑ प्रज्ञा॑ करे॑ छे. लग्नाना॑ संकरना॑ भंदिर॑ हो॑ गमे॑ गाम॑ अनवा॑ वार्या॑ छे॑ तेम॑ ज॑ लुही॑ लुही॑ भाताना॑ भंहिरो॑ अने॑ स्थानांड॑ स्थापातां॑ नय॑ छे. अही॑ना॑ आहिवासीओाँ॑ देव-देवीओा॑ अगो॑ के॑ विजेता॑ मेलवरगाना॑ आरी॑ ते॑ उपरवी॑ नीचेना॑ तारण्हो॑ नीकणा॑ शह॑ एम॑ छे॑:

(१) आ॑ तातुकानो॑ समय॑ आहिवासी॑ समाज॑ युस्त॑ डिंदुधर्मनो॑ जल्हाय॑ छे.

(२) हिंदुधर्मनो॑ अद्वा॑ देव-देवीओाँ॑ श्रद्धा॑ धरावे॑ छे॑ अने॑ लुहा॑ लुहा॑ देवीनी॑ भूर्तिपूजामां॑ पञ्च॑ भाने॑ छे॑.

(३) आहुनिक॑ सुधरेये॑ समाज॑ एमना॑ प्राचीन॑ देव-देवीओाँ॑ लुहा॑ लुहा॑ नामथी॑ पूजतो॑ थेये॑. दा.त. अरमेहने॑ अक्षा॑, डिरवादेवने॑ चिन॑, महालक्ष्मी॑ भगवती॑ वगेर॑ नामथी॑ पूजे॑ छे॑.

(४) आ समाज डेटलीक अंधशक्ति अने लगत-भूवार्मा भाने छे एना प्रभाषणमां बहु ज्ञेष्ठा खयां थयो छे अने जूनी परंपरा मान्यता वजैरे चालु ज रही छे. अदीनो आहिवासी समाज कुंआरे जनावेशा मार्टिना भिक्षिना जूना धुम्रपाणी धरणी राखे छे अने एने पछु 'अरमहेव' तरीके पूजे छे. उपरात देवाना आकाशी नानी प्रतिमां भाने देवताना वादन तरीके पूजे छे, वाखने पथ्य पूजे छे.

(५) आ समाज लगत-लगताण्यांनी आश्रय दे छे, अद्वापूर्वक भानताच्या भाने छे तेमज भांत्र तंत्र होय वागा वजेरेमा अद्वा धरावे.

(६) वर्तमान आहिवासी समाज धारे धारे भीज जातिना लोडा साथे संपर्कमां आववायी भीज संप्रदाये तसेह अद्वा धरावतो थयो छे.

(७) वर्तमान आहिवासी समाज डाई पथ्य जातनी लखुतांच्यि विना जेतानी जति विशे गर्व अनुकरे छे. अभेजे जेतानी जूनी इडियो फुल चालु रापी छे. अधारस्थाय अदिक्षारना लावो मेणवी आ समाज राजकीय अने समाजिक जगृति अनुकरतो थयो छे. परिष्यामे जेज्ञानी धार्मि परिस्थितिमां पथ्य केलाक इक्कार थया छे.

(८) जेतानी अगवी संस्कृति अने संवयता जगवी राखवा आहिवासी समाजे विधमांज्ञानां कृ भीज डाई पथ्य प्रकारनां प्रदेशालन छाडी देवानी ज्वर छे. जेतानी पुराणी रीत-सम अने आहिवासी अस्तिता टकावी राखवानी दावमां भूम ज्वर ज्वी थई छे. आ विद्यामां संकिय अनी कामगीरी करवा परम पूज्य अभ्यानंष्ट महाराजनी देखरेख हेणी सनातन सेवा संघ-पारीनी रक्यना थई छे.७

#### पाईटीपा :

१ दृष्टी मोहनलाई भी, घाडिया ज्ञतिनो ईतिहास-११७६, पृ. १३

२ जेवजन, पृ. ३ ३ जेवजन, पृ. ३

४ 'दृष्टिया आहाडेन्टिक्स', ले. रेयशीलनी अॅन्ड रीजवी, ओस. ओय, ओम. भी.आर प्रकाशिका, दिल्ली, १९८५, पृ. ८

५ उमिं डाईमन, डेगी आदिलोन, सेन्टर दैर सेक्षियल स्टडीज, सूरत, १९८६, पृ. १६

६ जेवजन, पृ. ४१

७ पटेल रमेशुभाई देवाभाईनी इमरू मुलाकात, गाम ठुमकाव, ता. पारडी

स्थापना : ता. ११-१०-२७

इमान : ५५२२६१/५५८३५०

## धी अरोडा सीटी कॉ-ओपरेटिव एन्क, लि.

रज. ऑफिस : संस्थावसाहत, रावपुरा, वडावडा-३६०००९

शास्त्रांग : १. सरदारखवन, जयुलीदी वाग पासे, टे. नं. ४४१८२४

२. पथ्यरोट पासे, टे. नं. ४४१६३१

३. झेंगंज, चर्यांनी सामे, टे. नं. ३२६३६४

४. सरदार छावालय, कारेलीवाग, टे. नं. ३४८१२

५. जडाताळा पासे, टे. नं. ३२८३४६

हेरेक प्रामाण्य एन्किंग कामकाल करवामां आवे छे.

मेनेजर : कॉर्टिभाई डी. पटेल

मंत्री : अंद्रकंतभाई चु. पटेल

प्रमुख : ही कॉर्टभाई पटेल

जन्मार्गी/१६६१

## માઉન્ટ આણુ અને ગુજરાત

શ્રી હૃદસુખ યાસ

આંતરરાષ્ટ્રીય હિવર્ટેશન તરીકે સુપ્રસિદ્ધ આણુ પર્વત ગુજરાત રાજ્યથી લગભગ ૨૫-૩૦ કि. મી. દૂર હોવા છતાં આને એ ગાજસ્થયન રાજ્યનો એક સાગ છે, પરંતુ એક સમય એવો પણ હતો કે એ ગુજરાતનો ભાગ હતો. આની પાછળ લાંબી રાજકીય કથા છે. એ દ્વારા જોઈજો.

આ. આણુ ભૂતપૂર્વ શિરોહી રાજ્યનો સૌન્ધ-દિણ્ણે મહરવપૂર્વ ભાગ હતો. ભૂતકાળમાં એનું અવિપત્ત ઘટનાઓ કરતું, અર્થात् કચારેક એ ભારવાડનો હિસ્સે. અની રહેતું તો કચારેક ગુજરાતનો. પરંતુ અંગ્રેજોને આણુ પર્વત હતું આવાના સ્થળ તરીકે પસંદ પણાં ઈ. સ. ૧૬૧૭ માં એનોએ એને શિરોહી રાજ્ય પાસેથી ભાડા-પદ્ધતિ લીધું ત્વારથી ભારત સરતન વધું ત્યાંસુધી એ અંગ્રેજોને અધીન રહ્યું. તા. ૫-૮-૧૬૪૭ ના રોજ ભારત સરકારે આણુ પર્વત હુનાં શિરોહી રાજ્યને સેંપતાં એ રાજકીય અટપટ(?)નું ઘામ અની રહ્યું.

પૂર્વ નોંધું એન તા. ૫-૮-૪૭ ના રોજ આણુ શિરોહીને પાછું સોંપાતાં ગુજરાતે આનો સુખત વિરોધ કર્યો. ગુજરાતના દામ પ્રમાણે ભૂતકાળમાં આણુ ગુજરાતમાં હતું, ગુજરાતના રાજનોટું એના પર શાસન ચાલતું અને સૌથી મહાનની લાલી એ હતી કે એ ગુજરાતાભાષી હતું. સ્વ. કલ્યાણ મુનશીએ ‘મહા ગુજરાતની યોજના રજૂ કરી, આ યોજના અતુસાર શિરોહી નેમજ રાજપૂતના એજ-સીના ગુજરાતી ભાષા-લાંબી મદ્દેશો, જેવાં કે વાસવાડા દુંગરપુર પાલનપુર અને ઈરદ રાજ્યને ગુજરાતમાં મેળની ‘મહાગુજરાતની રચના કરવામાં આવે. નવે. ૧૬૪૭ માં સરકાર વલબભાઈ પટેલ સમસ્યે આ યોજના રજૂ કરાઈ. સ્થળપણ દોકનોના વિરોધના કારણે દુંગરપુર અને વાંસવાદ યાત્રાની રાખાયાં, પણ શિરોહીને પદ્ધિમ ભારત અને ગુજરાત એજન્સીમાં રખાતાં આણુ ગુજરાતનો એક હિસ્સો અની રહ્યું.

આર્થ. ૧૬૪૮ માં રાજપૂતનાનાં દિક્ષિય અને દિક્ષિય-પૂર્વ ભાગમાં આવેલ રાજ્યોને મેળની ‘સંયુક્ત રાજ્યથાત’ નામનું એક નવું રાજ્ય અનાવવાની યોજના ભારત સરકારના વિચારાધીન હતી. આ દરમાન ભારત સરકારે પદ્ધિમ ભારત અને ગુજરાત એજન્સી-અંતર્ગત આવેલાં રાજ્યોને મુંબઈ રાજ્યમાં બેન્જારી દેવાની નિષ્ઠય લીધી, આથી હવે પ્રથ એ ઉપરિયત થયો. કે શિરોહીને સુંખુઈ રાજ્યમાં બેન્જારું કે સંયુક્ત રાજ્યથાતનાં. આ અંગેની વાદાવાટ કરવા સાઢુ ભારત સરકારના તાત્કાલીન દેશી રાજ્યોના સાચન થી ની. પી. મેનને રાજ્યથાત પ્રદેશ ડોન્ચેસના અધ્યક્ષ અને શિરોહી રાજ્ય એજન્સીના ડાલિનાલ-ચલાહડાર શ્રી ગોકળાઠ અદેન હિલ્ડો મોલાન્યા. તર્ફ (હિલ્ડામાં) વાદાવાટ-વિચારવિમર્શ દરમાન શ્રી લંદેશિરોહીને ડોઈ રાજ્યમાં ન મેળવતાં હાત પરતું કેન્દ્ર-શાસિત રાજ્યનો અલિપ્રાય-મત દર્શાવ્યો.

આ દરમાન તા. ૧૮-૪-'૪૮ ના રોજ સંયુક્ત રાજ્યથાતનું ઉત્ત્રવાટન કરવા પં. નહેનું દુંગરપુર આભ્યાસ તારે લોડેનો અને સ્થાનિક નેતાઓએ શિરોહીને રાજ્યથાતમાં જ બેન્જારવાની જોરદાર માગણી એમની (પ. નહેનુંની) સમસ્યા રજૂ કરતાં પહિલાંથી શ્રી મેનનને એક પત્ર લખી અણ્ણાયું; ધ્રુવા ન્યક્ત કરી કે ‘શિરોહીને ગુજરાતમાં મેળવવા સામે લોડેના તીવ્ય રોષ હોઈ જનતાની ધર્યાને માન પથિક

જાન્યુઆરી/૧૬૬૧

૧૬

आपुः” अर्थात् शिरोहीने गुजरातमां न लेणवाउँ. आगे ज्वाप आपतो श्रीमेनने (ता. २२-४-४) श्री नहेने लभ्युँ के “शिरोहीना प्रस्त्रे लेडी साथे व्यापक विचार-विमर्श” करेक छे अबे होइ मुदने ध्यानमां राखीने ज अने गुजरातमां लेणवानो निर्णय लीपेल छे।”

छेवटे श्री गोकुणलाई लहट द्वारा अपारेक भत अतुसार ता. ८-११-४८ ना रोज शिरोहीतुं प्रशासन केंद्र सरकारे लीडु ने श्रीमेने एमा प्रथम प्रशासक अनावापां आ०या, परंतु, ता. २२-१२-३८ ना रोज राजभूतानाना रीजिस्ट्र कैमिनर श्री कृ. भी. पिल्लाईचे केंद्र सरकारने एक रिपोर्ट भोक्त्वा रपष अभ्यास्युँ के “शिरोहीना प्रशासकशीमे संचायांचं उच्चय अधिकारीमेने मनसवी रीत अमाना पद्धेयी हर क्यों के, अट्टुं ज नलि, लोकेमां असांतोष पण वधी रखो होइ राज्यमां थांति ने अवश्य लागवाच शिरोहीने केंद्र सरकारे कां तो गोताना सीधा आसन नाये तत्काल लेतुं अथवा पदेवना कौर्ह राज्यमां लेणवी हेतुं उचित गंभीरो。” आ रिपोर्टना आधारे भारत सरकारे ता. ५-१-४८ ना रोज शिरोही राज्यने गोताना तरक्की केंद्र सरकार वली-वहीनव अलावा मुंबई सरकारने सोधुँ. अहो अ वाद रहे के आ समये गुजरात द्वि-कांशी मुंबई राज्यतुं ज एक अंग हतुँ. आम, आखु गुजरातमां लहटुं कही शकाय.

परंतु शिरोहीना लेडीजे भारत सरकारना आ प्रवानो समत विरोध क्यों. ता. १-४-४८ना रोज शिरोही गिल्ला डोंग्रेस समितीचे एक प्रस्ताव (करव) पसार की शिरोहीने तत्काल राजस्थानमां लेणवानी आगेयी हरी, परंतु सरकार पटले अगेना कौर्ह परवा क्यों विना शिरोही-विभागनेतो भक्तम निर्णय लीदी. श्री कृ. भी. मेनने श्री गोकुणलाई लहट तेज अन्य स्थानांप नेताओने दिल्ही तेहवी सरकारना निर्णयनी आजु हरी. आ नेताओने प्रारंभां तो अने विरोध क्यों, लोह-आंदोलननी धमकी पण दीदी, पण यांते समाजवर्था अगेअ अने स्वीकारी लीदी। सरदारशीना गोतानुसार लन्युआरी, ५० मां भारत सरकारे शिरोहीतुं प्रवाना करी, आखु पर्वत अने टेकवाळ मांतना ८८ आगेने मुंबई राज्यां अने आकालां लागेने राजस्थानमां लेणवा दीदी.

भारत सरकारना उपर्युक्त निर्णयां शिरोही राज्यमां व्यापक जन-आंदोलनने सह थयुँ अने आ हरभ्यान ज सरदारशीतुं अवसान थयुँ. भारत सरकारे वधता जता लोह-आंदोलनने ध्यानमां क्षेत्र आंदोलनारायीमेने “विभागना निर्णय पर पुनः विमार करवा”नी आतरी आपतां आंदोलन समेटायुँ अने अंततः राज्य-पुनर्गठन-अयोगी लढामधूना आधारे ता. १-११-४६ ना रोज भाऊन-ट आखु तेज टेकवाळ मांतना आपां गमो मुंबई (गुजरात) राज्यमाथी लहट पुनः राजस्थानमां लेणवी हेवाया. आम त्यारथी आखु पर्वत पण राजस्थानना एक हिस्से अनी रहेल छे.

**नोंदः** नव भागमा प्रसिद्ध “गुजरातनो राजकीय अने सांस्कृतिक धर्मिणास”मां आगा विशे होइ ज चर्ची थेल नथी।

६. शाहरवडा, अमरंडोरखा-३५१४५५

## મહરસંકાતિનું દેશવૈવિદ્યે જટુ પર્વ

શ્રી. દીપક જગતાપ

મહરસંકાતિ અથવા ઉત્તરાયથતું પર્વ જટુમાં આવી રહેલા પરિવર્તનની જી ગેડારે છે. સર્વની ઉત્તર જોગાર્થ તરફની વતિ નિમિત્તે આ પર્વ જિજ્વવામાં આવે છે. ૧૪ મી જાન્યુઆરીએ જિજ્વવામાં આવતા આ પર્વ દરમયાન ટેવો ગોતાની લાંબી નિદ્રા બાદ જગત થના હોવાની માન્યતાને પગદે આ દિવસે લોડા દાનપુરુષ કરે છે.

આરતની સર્વસ્તુતિ અને એના તહેવારો હંમેરી વિવિધતા-સભર રહ્યા છે. દર વર્ષે ૧૪ મી જાન્યુઆરીએ આવતો પતંગત્સવ સમય દેખમાં હોશભેર જિજ્વવાપ છે. (ઈ.સ. પ્રમાણે તો એ પ્રતિવર્ષ ૧૨ મી એ, પછી ૧૩ મી એ અને હેઠે ૧૪ મી જાન્યુઆરીએ હોય છે.)

આ દિવસે લોડા પ્રાતઃકાળે વહેલી જીઠા, સ્નાન કરી શરીરે દોપ લગાડે છે, દિવસે સર્વંતું પૂજન કરે છે. અગ્નિમાં તલ હોમનાનો પણ રિવાજ છે. એણા પૂર્વને પણ અર્ધ આપે છે. આ દિવસે સમગ્ર ભારતભરમાં તલનો જ ઉપયોગ થયા પાણની એક માન્યતા એવી પણ છે કે એનાથી પાપનો નાશ થાય છે. લ્યાયો આસ વસ્ત્રાદારો ધારણ કરે છે. આ દિવસે સેરેચી સુજ્વાનો રિવાજ પણ છે. એનાથી દાંત સાંક થાય છે. એ દિવસે નાગરવેલનાં પાન, કંડું, નાળિયેર તથા અન્ય મસાલા અને વખતું દાન પોતાની માતાઓ પુરીને અથવા તો એમની રાતની અન્ય લ્યાયો કરે છે. વળ અલાણુને દાન આવાનો પણ રિવાજ છે. અલાણુને વડા ગોળ તલ જીન સેતું દૃઢું તથા કપળનું તેમજ ગાય અને વોદાનું દાન પણ પણ પદમાનો પોતાની શક્તિ સુજ્વાની આપે છે. આ દિવસે ડેટલાક લોડા ઉપવાસ કરે છે અને અન્ય લોડા સરી વાગ્નાયો. જનાવે છે. આ દિવસે અલદ ભાપણ કરવાની તેમજ વાસ કાપવાની કે પાન તેવાની તેમજ ગાય વેદી કે અફરીને દોહવાની પણ માટે હોય છે.

જુદ જુદ પ્રાતોમાં આ પર્વ જુદી જુદાં રીતરિવાને સાથે જિજ્વવાપ છે. જુદ્જરાત અને રાજસ્થાનનાં એ સર્વાપૂજન પિતુર્પણ અને તલ સાથે જુદ્જદાન કરવાનો કે અહીંબોજન કરવાને એમને દિક્ષાણાં કાચી ભીયદી કે સાંઘ સાથે એ કુલમાં તલના લાડુ દિક્ષિણ તથા ફળજ્વાહ આવાનો શરૂરતો છે. મહિરોના દેવર્થન કરા ગયોનું પૂજન કરે છે.

ગુરુર્યો પોતાની નરી પરણેલી દીકરને ઉત્તરાયથતું દાન આપે છે તેમાં કુંઝી ગોળી કે મેદું વાસ્તુ આવે છે, એમાં સાકર ગોળ કે આર્દે કરે છે. રાજસ્થાનના 'સુદી' કે 'મહારાષ્ટ્ર'ાં 'માગલિંગ' નિમિત્તે પરણેલી દીકરને આ જ પ્રમાણે દાન આપાય છે. સૌરાષ્ટ્રમાં ભીસરે (સંસ્કૃતસર દિવસને) બસારો એણાં થવાનો દિવસ) પર્વ જિજ્વવાપ. આયો આપણેને નહીંએ લઈ જઈ નવરાત્રે, પૂજે, દાર પહેલાં, અદ્વારાયા શાલુગર અને પછી દેંડપદ્ધો યોજાય.

અંગ્રેજ મદાસ તાનિણાનું કેલેખ વગેરે દિક્ષિણ ભારતમાં આ દિવસે ભીર જનાવી દ્યદ વગેરે દેવાને ધરાવાપ, ગાયનું પૂજન થાય. તમિણાનું નવું વરસ આ દિવસે ગાય થાય છે. એમનો આ તહેવાર 'પોગળ'ને નામે જાણીતેનું છે.

અંગ્રાણના આ દિવસે રાયરચીલા ઉપર વાસની હોરીએ બાંધવામાં આવે છે. એનાથી જેતિનો પાક ખૂબ જિતે એવી કામના કરવામાં આવે છે. એ દિવસે લોડા ગંગાની જાપા કુરીની નહીંમાં [અનુસંધાન આ. ૨૩ નીચે]

પથિક

જાન્યુઆરી/૧૬૬૧

૧૧

## આજાહીનો વીર સૈનિક

[સત્યવદ્ધના]

‘ડીંડ છેઠાની લગત થએ થાપ એ પહેલાં જ બિંદિશ સરકારે દેશભરમાણા હનરો ક્રોનેસી નેતાજોની એકાએક ધરમકા ક્રી લઈ એજાને જેવના સંગ્રહા પાંડળ બડેલી દીકા. હવે શું હરતું એની વિમાસલુંના પેદા શાંત અને ડિંકાંબ્યાદું કોઝાના ટોળાંન્યા. પર લાધીએ વાંગીને તથા ગોળાનારો કરીને સરકારે દેશના યૌવનને પડકાદું. એમાંથી ભયંકર દ્વારાના ભાષકી જિંદ્ગો. ભારત માતાની મુહિતના આપની યથમાં અનેક દ્વારમાં જુવાનોના વિવિધ દેવાયાં, હિંસા-અહિસાનો લેદ થોડા સમય માટે શુદ્ધારી જનો. “કરેં યા મરેં”ની ગાધીજીની આપની હાકલ સમય દેશના જુવાનોનો શુરૂમંન વતી ગઈ.

ધિંદિશ સરકાર સાંચે ડીંડ પણ રીતે લડી દેવાના યુસ સંદેશ જુવાનોને મળના લાગ્યા. આ લગતમાં અમદાવાહ કેટલાક થરવારો પેદા કર્યા હતા. ૨૧. કોહુઆઈ પુરાણું યુસ ફંતિદારી માંણ સમસ્ત ગુજરાતમાં વાપેતું હતું. સરકાર અગ્રતારિંદુ, ચંદ્રોભર આજાદ, અદૃક્ષેર દત્ત નેરે એજાના આરાધ્ય દેવો-સમાન હતા. અમદાવાના કેટલાક મરજુના જુવાનો હથિયારો મેગવાના કામના લાગ્યા. એજાને આસપાસના પ્રદેશાભાસી યુસ રીતે શબ્દો ખરીદવા માંચ્યા; આસ કરીને દેશી રાજયો-માંથી હથિયારો વેચાતી મળી શકતાં.

અમદાવાના કેટલાક કુયાર્દી-કાંપ્યુનોએ સરકારનો સાથનો કરવા માટે શબ્દો અંગીદી ભેગાં કરવાની યોજના બઢી આ. રીતે શબ્દો ખરીદી લાવના માટે એક વ્યાયામવીરની પસંગી કરવાના આવી. અમદાવાહથી એ વ્યાયામવાર એકલા તણોક હનરો રૂપિયા લઈને લીંબડી રાખ્ય તરફ રિવેલર ખરીદવા જયા. પોતાની પારો પણ એક રિવેલર અને તેઓં કારતૂસ હતાં. અભાદાની તાતીમથી એ જુવાનનું શરીર કસાયેલું હતું. એ રસ્વાયે અણાદુર અને સાહારંદ હતા.

લીંબડી ગામની કાગેણ પાંચ માલ્યાઓ નિંબાંથ સથળે રિવેલર વેચવા હાજર થઈ જયા હતા. અગાઉથી નક્કી કરેલી નિયાનીએથી એજાને એજાની લેવામાં આવ્યા. એ પણે માલ્યાઓ પારો જાંદું ભાલા વગેરે હથિયારો હતાં. દેશની આજાહીની લગત સાથે એજાને કાંઈ લેવાદેવા નહીંતા, એજાને માટે તો પેસા પાંચ જેવાનો ડીંડ સુંદર અવસર માસ થયો હતો.

‘તમે અમદાવાહથી આવ્યા છો ?’

‘હા.’ વ્યાયામવારે જવાબ આપ્યો.

‘જ્યાંતીભાઈએ મોકલ્યા છે ?’

‘હા.’

‘પેસા લાંબા છે ?’ વેચનારાએ પ્રથ કર્યો.

‘હા.’ જુવાને દુંકાંભ પતાંયું.

‘દસ હનરો રૂપિયા થશે, પરહેઠા અનાવણની જીંચી જાતની રિવેલર છે !’

‘અને દેશની આજાહી માટેનું કામ કરીએ છીએ, એટલા ભાવ રૂપિયા કચાંથી લાનીએ !’  
વ્યાયામવારે કહ્યું.

‘અમારે તો પેસા લેઈએ. આજાહી સાથે અમારે શું ?’ આજાહીને ન જાણતાર ધનને દોબિયો ગોલ્યો.

‘આપીશું. પણ રિવેલર બરાબર ચાલે છે એ તથાસી લેવી પડશે.’ એમ છી એ વ્યાયામવારે

૨૩

અન્યુદ્યારી/૧૬૬૧

પદ્ધિત

રિવોલ્વર લાયન લીધી અને જેમાં છ ડારતુસ લર્પી. એક જાડ પર જોગીઆર કરો અને રિવોલ્વર સારી છે જેણી આતરી કરી લીધી.

એટલાં પેલા પાચે માણસોએ 'ચાલો, ઇપિયા કાઢો' કહીને એ રિવોલ્વર અને એ સ્વાતંત્ર્યબીર પાસેના ત્રણ હળવ ઇપિયા ઝુંટ્યી દેવાનો પ્રયાસ કર્યો. તરત જ એ સ્વાતંત્ર્યબીર નીડરતાથી જેમાંને 'ફેન્ટ્યુલ અપ' કરાવી દઈ એક અણુ પર જોગીઆર કર્યો. અને કપાળમાં ઠણ કરીને નીચે પાછી દિયો. બાકીના ચારે માણસો ગજરાઈ ગયા અને નીચે પડેલા સાથીને બઠાને નારી ગયા. વધુ જોગીઆર કરવાની કરત ન રહી.

સ્થળેથી જેણે માર્ગદર્શની મજલગ દોડતો, કાપીને એ વ્યાયામનીરે દેખવે રહેશેનેથી જારી પડી અને એ જોંચી જાતની કર્મન અનાવટની રિવોલ્વર લઈ અમદાવાદ જાવી ગયા. એની પાસેના ત્રણ હળવ ઇપિયા અને રિવોલ્વર પેતાના નેતાને સોખી દીધાં. એષે પેતાની પાસે જેમાંથી થોડા ઇપિયા પણ ન રાખ્યા.

"એમને નથી યથા: પ્રાહિની મહેના, નથી પુરસ્થીનો મોહ,

એમને નથી અનતું પ્રથમાન, નથી બન કે જાતાની લાલય;

એ તો લાદા'તા, મા-ભેગભી મુક્તિ કાણે,

એમણે નોંધું જાણ્યું કે એમને પણ શી આકૃત ખી હતી !"

એ સ્વાતંત્ર્યવીર તે મોહનસિંહ સોલંઝા, બાજારના મુક્તિનિદ્રા મહીમે પેતે શિક્ષા અન્યા ડાતા,  
કે. ૫, રનાપાઈ વિલાગ-૧, બાટલોલિયા રોડ, અમદાવાદ-૩૮૦૦૧૧

[અનુસૂધાન પા. ૨૧]

સ્નાન કરે છે. ભારતભરમાંથી અહીં લગભગ લાખ લોડો ત્યાં સ્નાન માટે જીમટી આવે છે. આગરદોખાના ઉત્તર પરદેના ડિનારે એ હિવસે મેળો ભરાય છે તે એક પખવાલિયું ચાલે છે. એ હિવસે રતનથી પણ સમુદ્રનું પૂજન થાય છે.

ગુરુને હિવસે કાશીમાં સ્નાનનો મહિમા છે, રામનવમીએ અગોધારનાનથી પુણ્ય માસ થવાનું મનાય છે. એ હિવસ્થી માધ-મેળો પણ શરૂ થાય છે. આ મેળો અલ્લાહાયાદમાં ભરાય છે અને એ એક માસ સુધી ચાલે છે.

આંદ્રુપ્રેદેશના જેઝ્વો મહરસાંકિત પર્વને કુપિયં તરીકે જિજ્યે છે. આ પર્વના હિવસે પણ ખંખનને રસ્થાનારે છે. કાળો ચાલ્ચા કરે છે. 'ઉત્તરઅંદ્રમા' ૨ જોગી, મહારાષ્ટ્રમાં 'મિલનહિવસ' પંલભમાં 'સોઢી' વરે દ્રદે પ્રારો વિવિધ રીતે આ પર્વની જિજ્યાથી કરે છે.

આ પર્વ કુંવારી કન્યામો માટે પ્રતી કારણું કરવાનાનું છે. મહારાષ્ટ્રમાં એકખીનને તલગેળ આપીને મોદાય છે: "તીળ ચૂણ દ્વારા આણિ જોડ જોડો શેલા!" તલગાં ચીડાશ છે. અથ ચાંદે ગ્રેમ રહે એની નિશાની-દ્રેપે તલગેળના લાદુ કે તલગાંની એકખીનને વહેંચવાનો રિવાજ છે.

મહાકારતની કથા અનુસાર એમ કેવેના છે કે કીબીને ઈંગ્યામુખ્યુદું વરદાન મળોલું હતું અને કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરાન-પાંડુનેના પિતામહ કીયા હોરેના પણે લલાં લલાં વાયલ ચાંદુને આલુશાયા પર પડે છે ત્યારે એઓ સ્વર્ગમાં પ્રવેશ માટે મહરસાંકિતના હિવસે જ પેતાનું ખુલ્યું થાય એવી ઈંગ્યાથી મંયુને રોકી રાયે છે અને મહરસાંકિતના હિવસે જ દેલાગ કરે છે.

કે. સી-૩, વડિયા પેલેલ, ફારેસ્ટ ડોકોની, રાજ્યોપાલા-૩૮૨૩૧૪૫

પથિક

અનુસૂધા/૧૬૬૧

૧૩

## 'ऐलांबर्ड माताजी'

श्री. वीरकृष्णसिंह सेलांडी

जीवांबर्ड माताजी<sup>१</sup> स्थानक संगीत गामनी हडमा आवेदुँ हटुँ. आ स्थानक मही नहीना किनारे उपर धधाँ बोरोटी जिझुँ हटुँ, परंतु छावमाँ 'वल्लभाईरी यमर्व वारर रथेन' थयुँ तेने माटे ज्ञेष्ठी ज्ञीनमाँ आ जग्या पण संपादित करी लेवामाँ आवी तेवा हवे गामलोडी आ स्थानक जेना माटे भहरवतुँ हटुँ तेवा ढाकोरोना साथ-कुकारथी जीळु जग्याए अनावी रखा छे. आ अनावी जीवांबर्ड माताजीना स्थानको जैतिहासिक प्रसंग याह इतवानी तक अग्नि.

संगीत ऐडा जिवाना ढासरा तातुकामां सेवाविधा रेखवे रटेजेथी चार मार्हीजना अंतरे मही नहीना किनारे आवेदुँ येक नानुँ नाम छे, संगीत गामनी स्थापना विशे जेवुँ कडीवाप छे के ई. स. १५०१ माँ ज्ञेसंगलु (शतवर्ष सोलांडी) ढाकोर अहीं गाही स्थापी होती. आ ज्ञेसंगलु गोपरा शासना सेवांडोजीनी सोजित्रानी गाहीना वारसदार होना. सोजित्रानी गाही ई. स. १५८८ माँ भहरमुह ऐगडाए लांगती त्याना ढाकोर वाग्युदेवतु (जेतदंगल) तथा अमेना क्षाई योरोजु अहारवटु ऐडी ऐगडाने हेरान-परेशान करी गृह्णो. ये अने लाईजो तो अहारवटामाँ काम आव्या, परंतु अमेना पुगेजो लडत चाहु राय्या. आपरे थाकोर ऐगडाए समाधान कर्नु अने आ समाधान यथापी वाग्युदेवतुना भोटा पुत्र ज्ञेसंगलु संगीत वसावी अहीं गाही स्थापी.

ज्ञेसंगलुनी जीळु पेटीजे रतनलु थया. आ रतनलु अील पुत्र अगरसंगलु (अग्रसेन) होना, रतनलु भोटा पुत्र वाबलु गाहीजे ऐडा होना. वाबलु पछी जेओला पुत्र स्वर्गसंगलु अने पछी अमेना पुत्र अरन्धलु संगीतली गाहीजे ऐडा, परंतु जेओला निर्वाण रहेवाथी अगरसंगलुना पुत्र अजेसंगलु गाहीजे ऐडा. जेओले चांदालु सखतानलु अने स्वरोजु नमे वज्यु पुत्रो होता.

यहेजुने ऐड कुर्वीरा होता, जेओलु नाम राजकुरवर्या हटुँ. अमेना लग्न ई. स. १६८० (ई. स. १६२४)माँ उद्देशुरना महाराष्ट्राने त्यां थयां. आ प्रसंजे ऐड यारथ-यारथी जयवा (मागवा) आव्या. कहीङ्क अपमानन्दन असंग अनाना यारेहो योतानी कठारी येठामाँ भारी त्यां ज ज्व आपी होधा. यारथी योताना पति पाठण सती थही. पतिनी यिता पर ऐसाना जेषु ढाकोरने थाप आव्यो :

“कुर्वा वास देश नहि, भागेजे द्वियाण भोवते नहि, चारथु नायरो नहि.”

थाप संक्षेपातो ज वधु ढाकोरे जलराई थया. अओ उपर गौँहुँ संकट आव्युँ. ‘कांगडावास द्वेश नहि’ अने अर्थ तो ढाकी पुत्र-चंदान रहेहो नहि जेवो थयो, हीझीना हीझाने पथ वास आपानो हफ्ते होय छे, ये पछु नहि रहे जेवो थयो.

ढाकोरा भाईने पेचे पथ्या. धध्यु ज काकलूरी करी. आही माजी. दया इतवा विनंतीजो करी.

छेत्री धरीजे भाईने ह्या आवी अने थापतु निवारथ अताव्युँ :

“जमो, भारा पारे (स्थानहो) तमारा भोटा पुत्रना अने तमारी पुत्रीना भोटा पुत्रना आणमोवाणा उतरावरी तो तमारा वास यावतो रहेशो. सो वर्ष पछी आ थाप निर्मूण थयो.”

नेक यादाजु तो अपुन ज भरथ आव्या. अमेना पछी अमेना नाना क्षाई सखतानलुने गाहीजे ऐसाउवामाँ आव्या. आ पछी यारथु आही जीवांबाईना स्थानक उपर अमेना वारसदारो आगमेवाण उतरावा क्षामा होता. आजे धधाँ वधो पछी पथ संगीत सेवाप्रर(ता, ढासरा ज, ऐडा) धरी ग्रींआ(ता, जाधरा जि, पंचमाल) वेवक्षपुर(ता, सावली, ज, दौदरा) वजेरे गामेना रावणु ढाकोरो येताना भोटा पुत्र अने पुरोजीना भोटा पुत्रना आणमोवाणा आ पारे आवी उतरावे छे, ३१, द्याग्याप्र सेवायारी, भाऊलपुर, वडोदरा-३६००११

## કૃષ્ણ : ઈતિહાસ અને સંસ્કૃતિ

**પરિશિષ્ટ ૨ : સુધ્રારા-વધ્રારા**  
પાદદીપા

પૃ. ૨. અ. પહેલાં કૃષ્ણનો વિસ્તાર રખ્યા હિત ૪૫,૬૧૨ ચો. ઈ. મી. ગણ્યાતો.

અ. જ'ગ્ની, ભારી રેહર, લદ્રેસર તથા લખપતનાં જૂરી અદરો હજુ અસિતવમાં છે, પણ મહેરનાં ચાલુ નાદરો નથી.

પૃ. ૩. ઈ. સ. ૧૬૮૧ ની વસ્તી-ગણતરી પ્રમાણે ડેલ વસ્તી ૧૦,૪૪,૫૮૮, કુલ ગામ ફડ્ફાદ. તાલુકાવાર ગામેની સંખ્યા : (૧) ભૂગ (આવા સહિત) ૧૩૧, (૨) સુંદ્રા ૬૨, (૩) ભૂગી ૮૫, (૪) અમણાસા-૧૬૨, (૫) લખપત-૧૦૩, (૬) નભવાણા-૧૪૧, (૭) રાપર-૧૧૦, (૮) ભાયાં-૮૦, (૯) અંજાર-૮૦.

પૃ. ૪. કર્યાના મોટા રખ્યા(નિતર)માં ‘સુરખાનગર’ (અગન્યપક્ષી-કુદેમિન્ગોની વસાહત) તથા નાળા રખ્યા(પુર્વ)માં ‘ધૂમાભર’ (વેડા તથા ગવેચાના મિશ્ર આકારનાં વિચિત્ર પણું) માટે વિઘ્નાતે.

પૃ. ૪૪. નાની રાયથી ગમેથા માંડવાની ઢો. પુલિન વસાને પુરાતન હડપીય અવરોધો મળ્યા છે. એ ઉપરોક્ત તથાંથી છાવાના (ઈ. સ. ૧૬૮૦) પુરાતન રાયથી મામદ્યા થોડે દૂર શુણિયાસર તથા દેસંધ-પુર (અંજાર) નામે ગામદાંદ્યા નજીકનાં અંગેલ દીનાઓ ભર્યી હડપીય સંસ્કૃતિના અવરોધો તથા બીજાં અવરોધો મળ્યા છે. શુણિયાસર પાસેથી પાણથુગનો ‘મેગાલિથ’ એક મળેલ છે અને એવા વધુ મેગાલિથ કોણું વામતા પાદરમાં પણ અણ્યાં છે. નાની રાયથમાંથી વિશેષમાં પ્રાચીન પોટરીના નમૂના પણ મળ્યા છે. એક અન્યાંપક્ષાની કોઈ જાનપર પાછળ એક વેદેસાવાર લાલાસહિતનો આદેખાયો છે, બીજાંમાં એક પક્ષીયુગલ, વીજાંમાં એ પગ વળાને એટેલ ભાજુસહું ચિન્તા છે. ઇલ્લાંડીવાળું મારીનું (પક્ષેવ) સોલ તથા પક્ષેવ મારીની અદાંકાર અનાવવાની જાઈ પણું મળેલ છે.

પૃ. ૩૭. ‘શ્રી જેન્સ અન્નોસ-કૃત ઈતિહાસમાં પૂર્બાદ’ ઈ. સ. ૧૩૫૦ માં ખૂલ્યું પામ્યો હતો અને એની રાખ્યાં સિંધમાંથી લાખાણે ઈ. સ. ૧૩૫૦ માં જોગાનીને પદ્ધતરગતની ગાહી પરદરથાપિત કરેલ હતો એમ જાણુવેલ છે. જામ લાખાણું જામ ફેરીએ જૂધીના રાજમાના શાસનકાલનો સમય પણ ઈ. સ. ૧૩૫૦ થી ઈ. સ. ૧૫૪૮ સુધ્રાની અતોલેલ છે.

પૃ. ૫૮. અ. મહદૂદ બેગડાને નવરાત્ર-ઉત્સવ અંધે કરાવેલ તેથી એક હિંદુ સેવક એનું ‘ખૂલ ઝૂં’ હતું એમનું ‘મિરાને સિંહદર્દી’ જાણે છે. એનું ખૂલું હેડા માસની ભીમારી બાદ અમદાવાદમાં થેવેલ એમ શ્રી. શ. ૬. હેસાઈના એક દેખમાં જાણુવેલ છે, જ્યારે એનું ચાંપનેરની જત (ઈ. સ. ૧૪૮૪) પાછ ચાંપનેરમાં નવીં રાજધાની રાખેલ તથા થેવેલ હતું એમ પાચાગઠનો ઈતિહાસ જાણુવે છે.

અ. મહદૂદ બેગડાના મંત્રી ગદા શાહ આણુ પર તીર્થ-કરતું અંધે કરાબું હતું. ખીમા શાહ હાનુંખરી એદેવાતો.

ક. ઈ. સ. ૧૪૭૬ માં મહદૂદે દાવર-ઉલ્-મુદ્દને ધરસામનો પ્રયાર કરવા માટે તીર્થાણ્દ્ર તથા કર્યાની મેલાધ્યો હતોના. એનું એ પ્રદેશના તેડા તથા ખીમા રાજ્યપુરો પર જાસ ગુજરાઈ હતો તેથી તેથી એને મારી નાખ્યો હતોના. ત્યારથી એ ધરસામની ગણધરીની તરીકે આ પ્રદેશમાં વિઘ્નાત એદેલ છે.

પરિશિષ્ટ

પથ્થિક

[૧૦૫]

૧૦૬]

ખથિક

[કૃષ્ણ : છતિહાસ અને સંદર્ભિ

૬. શ્રી ક્રીસ્ટ અર્વેસના છતિહાસ પ્રમાણે હમીરિએ શાસન (ઈ. સ. ૧૮૨૫ થી ૧૯૪૮) લગ્ની અને એના રિસા ભીમળઠું શાસન (ઈ. સ. ૧૯૧૦ થી ૧૮૨૫ સુધી) હોવાનું જણાવાયું છે, પણ 'મુહુર્શોાંત નેછસીનો ખાત્ર' મુજબ એ ગારણ એમના પિતાના (હમીરિએના) ખૂન વખતે સગીર હતા અને રાવલણના પિતા લાખાણું એમને (એ ગારણને) ખસેરીને એમના (હીનીરાના) ગાડા પર રથાપિત કર્યા હતા, તેથી હમીરિએનું શાસન ઈ. સ. ૧૮૨૫ થી ૧૯૪૮ સુધી હોવાનું શરૂ થયું નથી.

૭. જામ હમીરિએના આરખારી ભૂખર થાહે રાપર મુહુર્શો મહુમદ એગડાને ભજાને નભરાણું ધર્યું હતું. હમીરિએની અનોરસ પુત્રી ક્રમાચારીને મહુમદ એગડા સાથે પરણ્યાની હતી અને મહુમદ એગડા ક્રમાચારી તથા એના લાઈ અવિયાળને પોતાની સાથે અમદાવાદ લઈ ગયા હતો. એમ એનાં સિંદરી જખુંચે.

૮. ઈ. અ. ઈ. સ. ૧૫૨૦-૨૬ ના અરસામાં સિંધના જામ હિરોજને થાહ દુસેને હરાનીને નસાડી ખૂદી સિંધ કંને કરીને આરગળ વંશની ૩૫૦ રથાપના હતી હતી. એણે જામ હિરોજ કૃષ્ણાંના નાસી આવીને આત્રય પાંચેલ તેથી જારા પર ચાઈ કરી હતી. હિરોજ ગુજરાતમાં નાસી ગયો હતો.

૯. સિંધના અમીરો આડીઓના તથા ગાળુભાન વંશે વારસા અંગે તફરાર અને સુદ્ધ થયેલ તેમાં રાપ એંગારણને બાડીઓનાને મદદ કરેલ. પાકળાંથી સમાધાન થતી બાડીઓને સિંધનો એ પ્રદેશ મળેલ તેમાંથી 'રથભાગનારનો પ્રદેશ એણે એંગારણને કેટ આપ્યો હતો.

૧૦. મીર જાનીએણ આરગળ વંશનો છેલ્દો શાસક હતો અને એને ઈ. સ. ૧૫૮૨ ના અરસામાં અફલરે હરાનીને કિંધ કણને કર્યું હતું.

૧૧. ઈ. સ. ૧૫૩૨-૩૭ ના અરસામાં બહાદુરશાહનું સુદ્ધ થયા બાદ એના લાઈ લતીદીઓનો પુત્ર મુહુમદશાહ ડલો ગાડીએ આય્યો. એનું ખૂન થયા બાદ ઈ. સ. ૧૫૪૪ માં સત્તાધારી અમીરોએ અહમદશાહ ૧ લાના વંશજને 'અહમદશાહ ડલો' નામથી ગાડીએ બેસાડ્યો. એનું ઈ. સ. ૧૫૬૦ માં ખૂન થતી સત્તાધારી અમીરોએ અહમદશાહ ૧ લાના બીજા વંશજને 'મુહુર્દેરયાહ ડલો' નામથી ગાડીએ બેસાડ્યો. એ ગુજરાતમાં છેલ્દો સુલતાન હતો.

૧૨. ઈ. અ. માંડવીએ શ્રી સુંદરવર મહિરાં ઈ. સ. ૧૫૫૧ નો જીલ્દારીએ છે તે મુજબ એ માંડવિની પ્રતિષ્ઠા માધ સુર્જ પના રોજ માંડવીએ મહાબનના સાથે રોજ જીગીહાસ, રોજ મંગલહાસ તથા નેસર રોજની હાજરીએ શીવલક્ષ્માયર્થાળાના બીજા પુત્ર વિદુનાયણ ગુરુચાઈણન પ્રથમ પુત્ર ગિરિધરણના નીંન કુમાર જોસ્તાના જોપીનાયણ ઉદ્દે દીક્ષિણલ મહારાજા(એ વખતે ઉ. ન. ૧૭)ના હાથે થઈ હતી. ('પથિ,' જુલાઈ-ઓગસ્ટ, ઈ. સ. ૧૯૪૭ ના ખાસ અંદરાં ડો. હરિપ્રસાદ શાખીને લેખ)

૧૩. કૃષ્ણમાં જમીનના અધાર વેચાણની અતોભાવ 'અધાર હમીરા વાર' લખવાની પ્રથા જામ પુંઅરાના સમયમાં હમીર સુમરાએ મદદ કરેલ એની ધારમાં ચાલુ થઈ હોવાનું કેટલાક છતિહાસલેખકો જણાવે છે, પણ આ માન્યતા અધારાંથી પુંઅરાના શાસન વખતે હમીર સુમરાનું અરિતત્વ નથી. ચંદ્રાવના એવી છે કે હમીરિએના ખૂન આદ જામ રાપથે કર્યાને પ્રદેશ કંને કર્યો, એને હમીરિએના પુત્ર એંગારણને હરાનીને ઈ. સ. ૧૫૪૮ ના અરસામાં કંચ્ચમાંથી તોડી મુકેલ અને કંચ્ચો પ્રદેશ પાડ્યો. કંને કર્યો ત્થારે જૂતા વખતથી જમીનના કંચ્ચનોરોતા માલિકોઠક એંગારણને કંચ્ચ રાખ્યા લાખથી અતોભાવ 'અધાર હમીરા વાર' દખાતું એ વધુ સંભવિત છે.

પરિશીષણ]

પથેક

[ ૧૦૭ ]

મ. માંડવીર્મા આવેલ રોપણુસર તળાવ રાવ પેંગારજી રૂલાના સમયમાં માંડવીનાં ભાડિયા ટોપયું રેઠે બ'ધાયું' હતું. એમના પુત્ર ગ્રીડમાસ રાવ ભારમલણના સમયમાં માંડવીના નગરસેહે હતા.

પૃ. ૬૫. અ. મુજફેરસાહ ઉજ (૧૯૬૦ થી ૧૯૭૮)ની છાવણીની સેંકડો કોરીએ કંચમાંથી મળેલ છે. વિશેષમાં સુલતાન મઝદ મિન લાલદીર(ઈ. સ. ૧૫૧૩-૧૫૫૪)ના તથા કંચના રાવના નામવાળા નોંધાના સિક્કા (દીકા) કંચમાંથી મળેલ છે. (હિસ્ટરી ઓફ ગુજરાત, વે. પ્રો. ડાનિસેરિયત)

પૃ. ૬૫. અ. કંચના એંગારજીના પૂર્વને 'ભામ' કહેવાતા અને જમશાહી (રાવ ભારમલણના વખતથી ચલણું અનેલ, રાવ ભારમલણની ભાવપણી કારોની જગેએ) કોરીનું ચલણ જ્યાએ હતું એમ ધીજેખાં જગીરમાં સચ નાયેલા અંગિયા (નાયનાથા તાલુકો) ગામના તાત્રપન (ઈ. સ. ૧૫૧૪ પોચ વિદ ૬) તથા એ જ ગામ અગેનાં અત (આવ સુર્ખિ ૫, ઈ. સ. ૧૫૨૪) પરદી જલ્દ્યાપ છે. તાત્રપત્રમાં અંગિયા ગામ જમશાહી કોરી ડરોંનો ૩૨૦૦ માં રાખારા રના વાયેરએ જાડા હાપા હરભાયું પાસેથા ખરીદેલ હતું. આ પુરાયા પરથી કંચમાં રાવ ભારમલણના વખતથી દિલ્હીના આદ્યાસાહ જહાંગીરના રાખણાસન વખતે જ પહેલવહેલા (સિક્કા પાંજાના) ધૂટ મળેલ હતી એમ હી રાખણ એમ નથી. કાચ જહાંગીરે રાખણને સિક્કા પાંજાનું ચાલુ રાખવાના હૂટ આપી હતો. ('પથેક', જુંબાઈ અંધ, ૧૯૭૪).

પૃ. ૬૬. જમનગરના જમ રખુણલણના સુર્કું બાદ એનો પુત્ર સંગીર સત્તાળને ગાડી પરથી ઉઠાડી મૂકીને એનો કાડો રાયસંગળ કંચના તમાચીણના મહદ્દીઓ જમનગરના ગાડી પર ચાડા એઠો (ઈ. સ. ૧૬૧૨ ના અર સામા), 'મિઠાતે આલગીરા' પ્રાણેણ રખુણલણના વખતા તરફથી ફીરિયાં થતા આદ્યાસના ફુકમથી જૂનાગઢના લાંકેને રાયસંગળએ સુદૂરા હરાવા મારા નાખ્યાને જમનગર કાંઠે કંદું અન સત્તાળને જમ તરીકે સ્થાપિત કર્યો. એ વખત રાયસંગળના સંગીર પુત્ર તમાચી કંચમાં રાખ્યના આશ્રમાં રથો હતો. શેડા વખત આદ ઈ. સ. ૧૬૧૫ ના અરસામાં તમાચીએ જમનગર રાજ્ય કામે અહૃતાવરું જરૂરીને તથા કંચની મહદ્યા જમનગરના ગાડી મેળવી હતી. જમ તમાચી રૂલામાં કંચ રાખ્ય રાખ્યનું અ ઉપકારના બદલાનું જમનગર રાખ્યાનું આલાંસા ગામ મેટ આપું હતું. થોડા વર્ષ બાદ તમાચી રૂલાના વારસ રાયસંગળ (જમ તમાચીનાં પુત્ર લાયાજીના મેટા પુત્ર)ન એના નાના ભાઈ હરદેવજીએ મારી નાખ્યાને જમનગરની ગાડી પચારા પાડી. રાયસંગળના પુત્ર તમાચી લાગાર હોતાં કંચમાં આશ્રત તરીકે રહેતો હતો. કંચના રાવ પ્રાણલણના અષ્ટ રાયું રતનાના હળવહેલા રાય જંશનતાસંહના પુત્રી તથા પ્રતાપાસ હનાં અહું થાય. તમાચી અમના લાયાજી થાય. પ્રતાપાસંહ પોતાની પુત્રી અમદવાદના કંચા શેરશુલ હાયાનત પરખાવીને અથી પાસેના સાતાની મહદ્યા હરદેવજીને જમનગરની ગાડી તમાચીનું ર જન અપાણી હતી (ઈ. સ. ૧૭૬૭). કાંચાળના વાણે પ્રથી સાંચા મોદા સેરાયીના ગાડીએ મેટા. પીળ વશાલે કાંચિયા લાકડાયા વાણીં વેરે ગમેના જગ્યારહાર. લાકડાયા જગ્યારહાર લડેલ દેવાળાં ઈ. સ. ૧૭૩૦ માં પીસના દરવાણ પાસે અનારા અંધાયા.

પૃ. ૭૧. મહાત્મા સંત મેદશ્ય સૌરાષ્ટ્રમાંથી કંચમાં આવ્યા લાર પહેલાં વાગણના કંગી માને થોડા વખતે રહેલ હતા અને અહીં 'આખાડો' સ્થાપાયો હતો.

પૃ. ૭૩. ઈ. સ. ૧૭૮૮ ની સાલ આદ્યા અનુભૂતિ અમદવાહનો વડીનાટ ગયકવાડને સોંપાયો હતો. પેશાને અંગરી ભરવાની રહેતી હતી.

૧૦૮

પથિક

[કબ્રાઃ હતિહાસ અને સંસ્કૃતિ]

૪૪. ભ્ર. મહારાવ લેખપતળના સમયમાં રામસિંગ ભાષણમાં પ્રયાસથી ભાગીમાં લોખાં ગાળવાતું તથા તોપો અનાવવાતું કરાયાનું સ્થપાયું હતું. છેલેવાય છે કે ઈ. એ. સ. ૧૮૮૪ સુધી કંસારા નેશુસી વીરળ તથા મેનળ તુલસીદાસ તોપ ઢાળવાતું કામ કરતા હતા. પણ ગુલમદાર નામે વિઘ્નાત જોકંદાજ જમાદાર હતેમાં પાસે નોકરીમાં હતો. બીજો નામચીન જોકંદાજ અને હવાલદાર હતો. એના વિશે ઉત્તિઃ “ભૂજ અડાલ, લિંગદ નાથ, માણું નાણ અનુ એવ વંદા.”

૪૫. એ. મહારાવ જોકણના વખતમાં સુંદરાવાળા મિરજાં અમોરખેગતું વર્ણિત હતું. સુંદરમાં એની વાડીમાં અહુ મીઠું પાણી હતું. ગામમાં દૂલ્હાઓ અથા આરાચાવાળા પાણીવાવાળા હતા તેથી મીઠું પાણી કરવા માટે શહેરનો ખોચેને નહી ખુંદીને મિરજાંની વાડી રેટથે દૂર નજું પણું. એની પરથી સુદ્રા માટે નીચેની સોડેકિલ પ્રયાસિત અનો : “સુંદ્રા ગામ મિરજાં (વાન) પાણી, દીકરી હેઠે એતું લાણી.”

૪૬. મહારાવ જોકણના વખતમાં ભાગીમાં વહાણો આંધ્રવાનો જડાંજવાડો પૂરણેસમાં ચાલુ હતો. સંખ્યાંખ વહાણો અંધાં હતો.

૪૭. એ. ગુલામશાહ ઈ. એ. ૧૭૭૨ માં સત્ય પામ્બો, એના પુત્ર સફરાને ઈ. એ. ૧૭૭૫ માં કંઈ પર ચાઈ કરી, પણ ભૂજની લરદારી તાકાત જેતાં એ કંઈકાટ તરદ્દ ગયો અને લાંબા ગરાસદારનો પુત્રને પરણુંનિ સિંબ પાણી ગયો. ત્યારાં કિંદનનો વચ્ચર ભાર બાજરે ઈ. એ. ૧૭૭૭ ના અરસામાં કંઈ પર ચાઈ કરી ત્યારે એને મિરજાં દુરપાયેણે હરાયો હતો.

૪૮. અનનતા જેગ છે કે ગાયકવાડ દમાળએ કંઈ પર ચાઈ કરી હોય અને એને પ્રસન્ન કરી પાણી કાંઠા માટે આધાતની કન્યા પરણુંવાનમાં આવી હોય. એને પરણુંવેલ કંતાતું નામ ‘રીઠા’ હોયાનું અહી કઢાનદાસે ‘આત્મચારેનાં જલ્દ્યાદે છે. આ સમયમાં ભરાઠ સોરાફું તથા બીજે ચાચાંએ કરતા અને રાન કે ગરાસદારનો કંન્યાઓંતો માર્ગ પણ કરતા એમ કહેવાય છે.

૪૯. એ. જમાદાર હતેમાંદે એક ચાઈ વખતે લાનગરસો કયાને કર્યો હતો, પણ સમાધાન થતાં દાની રહેની રહેની થયેલ તેમાંથી અસુધ રહેનો રોકડા તથા આજ હપેતાવા કરવાના અને ખાંધુની રહેની રહેની વધુંના દર વર્ષે ભરવા એમ હરપનામાં આંધું હતું. એક વખતે ગેઠળના મદદમાં પદવરા મુખમે લાનગરના રોન્ય સાથે દુષ્પ ખેલવલ તેમાં અંત સમાધાન થવું હતું.

૫૦. એ. મહારાવ રાયધયશુળના માતુંની પટરાણી લાડુંવરસા હતાં. જોકણના ખીલાં રાણી અમાઝાઈ ભાઈણ ભાવાનાં આ થતાં.

૫૧. ઈ.સ. ૧૮૮૨ ના ડિસેમ્બરમાં ગેચેરના ફેન્ડરલ્યાનું સત્ય થયા આદ એનો પુત્ર દીપુ સુલતાન સત્તા પર આવેલો. એષે જમાદાર હતેમાંદ સાથે મરા સાતુ હતી અને ‘હેરીં’ નામે મેરી તોપ જમાદારને લેટ આપી હતી. કંઈ તથા મેરા રાજ્ય (દાખ સુલતાનના શાસન) વરચે નેપારી સંખ્યા સ્થયાય હતા. ઈ.સ. ૧૮૯૮ ના ડિસેમ્બરના દીપુ સુલતાન અન એને વરચેના મુખમાં એની હાર થતા તથા સત્ય થયા આદ કંઈ સાથે વેપારા સાથે થો. અંધ પરચા હતા.

૫૨. એ. વિશેષમાં કંઈના સરકારે જોવથી પર આત્મચંદ મુખવા કાખું કાખું હતું.

૫૩. જમાદારના યાદ્યા ક્રમ ક્રમ નકટીબાળો ક્રમ અભયરા ઈ. એ. ૧૮૮૮ ના અનાવરાયાથો હતો, ને ભૂજમાં પાટવાઈ નાક અહાર આવેલો સ્થાપત્ય તથા કિલ્ફના સુંદર નમૂના તરીકે વિઘ્નાત કે.

પરિશીલન

પણી

[ ૧૦૬ ]

૫. ૮૭. જૂનામણના નવાચ ડામિદ્યાનતું પુત્ર ઈ.સ. ૧૮૯૨ માં થયું તારે એના વારસા આયતર્થ વાંદ્યો હતો. રાવનપુરી એગમનો પુત્ર અનાવરી હતો, જ્યારે રાજ્યભૂતાણી એગમનો પુત્ર મહેભતમાન અનોરસ હતો, એ તકરાર પરવે કર્મપની સરકાર વતી ટેચ્ટન મેકમાર્કેઝ તપાસ ચલાવી મહેભતમાન ઓરેસ પુત્ર હતો, જ્યારે રાવનપુરી એગમનો પુત્ર અનાવરી હતો, એવું કરવાં મહેભતમાનનો નવાચ તરીકે રાજ્યભૂતાણી થયો હતો. કર્મપની રાયપણુંના સુત્ર ખાદ માનસંગ્રહ એમના અનોરથ સંતાન (પુત્ર) હતા, જ્યારે બાંઠળાયાના પુત્ર લંઘાણ અથ વારસ હતા, એવી તકરાર માંડવાના દારબારી પિલાલ તથા ટેલાલ ગરાસદરોણે ઉડાવી હતી, પણ કર્મપની સરકાર તરદદી કંઈ દરઘનગરી (જૂનામણની માર્કેક) કરવાના આવી ન હતી, કેમકે જમાદારના પુત્રો તથા જગ્યાવન મહેનતું વર્ષે ક હતું; જેણે રાયપણુંને પોતાના વડીલ માર્કેઝ કર્મપની સરકારને પત્ર લખી માનસંગ્રહ પોતાનો પુત્ર તથા વારસ હોવાનું 'જલાયુ' હતું.

૫. ૮૮. રાબડુંગારી કેસરાણે સંભારમાં લાગ લીધો હતો, એવું અનેક જઘમો શીર્ષ ભરી હતું દરઘનગર વલોરને વાતાવરી હતી એમ અનેક ઇતિહાસવેદણ જણાવે છે.

૫. ૮૯. મહારાજ દેસલઙ્ણના મોદા પુત્ર રવાણ પદશાણીના પુત્ર હતા, જ્યારે અનેજ પુત્ર ગયુભા નામે હતા તે અથ રાણીના પુત્ર ચાચ. દેસલઙ્ણને ગયુભા તરદી વધુ આવ હતો. એમને એરાનો ગરાસ આયો હતો રવાણ તથા અનન્દ માટુંની સાથે અલ્યુનાવ થતી એંચો મુદ્રા રહેવા ગર્થો હતો. પછીઓ મુદ્રા મહારાજના પ્રયાસાના તમારાવ થયું હતું.

૫. ૯૦. કાલાર્ય માયમલાણના દાચનડાલ દરઘનગર રાજ્યની દંક્ષાળમાં પાંચ ડારીની કિંમતનો અંદીના પાંચદા અધ્યાત્મ ચાચ વહુ હતું. એ ઉપરાંત સેનાની ડારી (૨૫ ચાદીની ડારી જેટલી કિ મતના), સાના અચ મહાર (પદારત ભરાના કિ મતના) તથા સેનાની મહેર (એકસે ડારીની કિ મતના) છાલાના આચાલ હતા અન એ સક્કા વલખણા પણ સુકાયા હતા. મહારાજ દેસલઙ્ણના શાચનડાલના સાનાના પદારત (ચાદીના ૨૫ ચાદીના કિ મતના)ના સિક્કો પહેલી વાર કર્મચારી જપાયો હતા અન વલખણા સુકાયા હતા. સુવારા : હાર્દિકના જગ્યાએ 'હોરિપટકો' વાંચાવાનું

૫. ૯૧. ૯૨. ૧૮૭૭ ના શુભ્રના મુખ્યમનો રસા લાં થઈ હતો. એવું નવું મહાન જનાવાન માટે ઇન્દ્ર વહું કર્મચારા મુંન્યાના રંગ કલ્પણ નાયકના મુખ્ય રિસેન્સો હતો. પાયાવિધિ ઈ.સ. ૧૮૮૪ ના થઈ. મુખ્યમના સાનાના તરં ૪૨ સક્કા સુવચન સાસક્કા તથા કર્મચારના રાજ્યાંત્રીનો સમયના સંચયાંત્ર છ. ૧૮૭૫ના માનાના તમન અંદીના સંચયાંત્ર અને મૌખી કાન્યક કુલ્લાં યુત્ત હુંચુ તથા ખાન ચાચનડાલના ચાદીના સક્કા તમન વાગાના ચાદીના સંચયાંત્ર છે, વિદેશના સિક્કા પણ છે. ચાદીના જન્મનાનું ઈ.સ. ૧૮૮૮ ના કર્મચારા અનલું ઘાડાયા છે. કર્મચારી એરાવત હાથી (જેણે દ્વારાના ટાઇટ અભાર પડી છ) છ. પદરાયના ટાઇ કુલ્લાના હૃતમાનને મેટ આપેલ હેઠાં તોપ, અથ પણું જાં તાપ, લાખડાના કુંકા ઇંકા અથ ગોળ તાપ, કાન્યક શાસનકાલના લાલિલેખા પણ સુચનાના ૮. ૧૪ જૂન, ઈ.સ. ૧૮૭૭ ના રિપોર્ટ સાથે કર્મચારા શિક્ષયાધિકારી દ્વારાતરમ આ. અધ્યાત્મર કર્મચારાના માના જૂન સિક્કાંનોના ગંધુ થેથા કર્મચારા દીરાન ગણિતાઈ જસ્તાઈ સમક્ષ રજૂ કરું એ સિક્કા પણ મેંગનસમા સંયવાયેલ છે. હરિપીપ સમયના સાથે તથા કેટલાક અવશેષો ત્યાં સંચયાંત્ર છે.

૧૧૦]

પાઠ્યક

[ કબું : ઈતિહાસ અને જીંસ્કૃતિ

૫. દર. અમ. છ.સ. ૧૮૮૮ ના નવેમ્બરની ૮ મી તારીખ (અ. ૧૯૪૪ કારતક સુદૂર) ના રોજ નંબિ ૭ નોંબર સ્ટીમર વેટર્સ ("વીલાળી" તરિકે પણાયે) કરોચીથી પહેલી જ સંદરભાનું જવા માટે જિપડી હતી તે ઉપરની તારીખે સચારે માર્ગની-કાઈ આવી. અહીંથી ૭૫૦ ઉત્તાનું લઈ એ દ્વારા ગઈ. ત્યાથી ૧૮૫ ઉત્તાનું લઈને પોરાંદર આવી. એ વખતે દરિયામાં વોક્કાન જગતી પોરાંદરના ઓડમિનસ્ટ્રેચર લેવાએ ર્યાન્ડરને આપ્રેન નહિ વખતી દેવા કેચેનને સલાહ આપી, પણ એણે માન્યું નહિ. પોરાંદરથી એક પણ ઉત્તાનું ચુલ્યા દેવામાં ન આવ્યો. સ્ટીમર તોષાનમાં આગળ વધી, વેરાવળ નજીબ દૂધથી દેખાઈ, પણ વેરાવળ અને માંગશળ વચ્ચે દરિયામાં લય્યકર તોષાન વરંચે ઇસાઈ જઈ શકી વારમાં જોતનેતામાં દૂધી ગઈ, સ્ટીમરમાં કુલે ૧૩૦૦ (તરસો) ઉત્તાનું હતો તે બધા દૂધીને મુખ્ય પાર્યાં. અનેક જાણીના માખસુસે, મૌટ્રિકની પરીક્ષા આપવા જનર અનેક વિદ્યાર્થીઓ વર્ગે મુખ્ય પાર્યાં. હાલાકાર પ્રવર્તી રહ્યો. લોકડાયિને ગાયું : "કાસમ ! તારી વીજણા ૨, મખ ફરિયે વેરંબ થઈ."

૬. રિજનસી કાઉન્સિલના એક સભ્ય જલદિમંદીંદ્ર આલા હતા. એહા મહારાવ એગારણના મામા થતા અને પાછળી મહારાવ એગારણના લગ્ન જલદિમંદીંદ્રના પુત્રો ગાગણા સાથે થયાં હતા, જેમનાથી મહારાવ શ્રી વિજયરાજજુનો જનમ થયો હતો. જલદિમંદીંદ્ર રિજનસી કાઉન્સિલમાં એક વગ ધરાવતા અને દીવાન મંજુલાઈ જલદાઈ સાથે એમને મેળ હતો. રિજનસી કાઉન્સિલના પીળ સંભ્રાણી પેટી ભૂજના રવજુ છીરાંદ મેલ તથા મુંદાના શેડ અવલૂદાસ ઈન્દ્રાજ શિવજ હતા.

૭. ૬૫. નંબી ૮ કંકાણ કે.સ. ૧૯૨૮ માં નનું ભક્તન આધીને જેમાં સ્થાનવામાં આવી હતી. એહબંદ ૮ માના નાનાવણાં ચાંદીના પાણીયા અટિયો કોઈ તથા તાંબાનો રણ છ.સ. ૧૯૩૬(સ), ૧૯૪૨-૪૩(સ)ના છાચની ૮ કંકાણના જ્યાપાં હતાં. ચલણું નહિ આવેદી મહારાવ શ્રી વિજયરાજજુના નામવણી છારી ૫૦૦ ના નોટ તથા છ.સ. ૧૯૪૮ માં વહાર પડેલ 'ઝયાંડ' ભાપની આડાની છારી આઈ જ્યાપેલ હતી.

૮. અ. કબુંમાં 'આરસ્વતમ્' સંસ્થા તરફથી ડેવનાયુદ્ધેને વષ્ણાં વરોથી પ્રવતિ આદે છે. અત્યારે કબુંમાં 'સારસ્વતમ્' તરફથી વીસ ઢાઈસ્ક્રો (માંજી મુંદા નખત્રાણા અયણા લખપત્ર તથા ભૂજ તાલુકાનાં જુદાં જુદાં ગામોના) આદે છે. નિરક્ષરતાનિવારણ-પ્રવતિ પણ ડેવનાં ગામોનાં આદે છે.

૯. તા. ૪ મે, ૧૯૪૮ ના રોજ આરત સંઘ સરકાર વતી સેન્ટરી શ્રી મેનન તથા મહારાવ શ્રી અભન્નસંહજુના સહી થ્યેલ 'મંજીર અભિમેન્ટ'ની નવ કલમો (આઈસ્ક્રેસ) પ્રમાણે કંદુ રાજ્યનો વહીવટ કારત રાજકારને સોધાયો. એ સાથે મહારાવના આંગત અધિકારોને માન્ય રખાયા છે તથા મહારાવ (એમે એમના કુટુંબના થથ્યો)નો આંગત માલિકાની સ્થાને જ જમ નિધારોની યાદી એખોશીએ રજૂ કર્યો. એ મિલકારો પરના એમના હક તથા અધિકારો માન્ય તથા સુરક્ષિત રખાયા છે. એ મિલકારો સંખ્યાના કોઈ તકનર ઉપરિયત થાય તો લવાહથી નિવેદો લેવાનો રહેશે. મહારાવશી તથા એમના કુટુંબના સંખ્યાના ખર્ચ અર્થે વાર્ષિક સાલિયાણીની રકમ એમને હુન્તાથી ચૂકવવાનું હરાવવામાં આવેલ છે (પાછળાથી સાલિયાણું અન્ય રાજવીજોની એમ જ રહ થ્યેલ છે).

૧૦. શ્રીમતી નાયાંથાઈ દાસોદર દાસરી મહિલા વિશ્વિવાલયના મુખ્યદાતા શેડ સર વિલુંદાસ દાસોદર દાસરી હતા. એમના પત્રી લેટી પ્રેમલીલા વષ્ણી વર્ષો સુધી મહિલા વિશ્વિવાલયના મુખ્ય સાંબાલ (વાઈસ-ચાન્સેલર)-પકે હતા.

## परिशिष्टा]

## पथिक

[ १११ ]

६७. अ. कृष्ण मांडवीना जहाजवाडामां कृष्णी कारीगरेना हाथे कृष्णना एवं वर्षतना भिक्षुनिक्षुल इक्षुनियर कंसाग लादवलु मुद्दू दीनी हेपरेख हेठल कृष्ण राज्य माटे अंधायेव स्टीमोंन्य नामे 'रंगमती' ई.स. १८३० ना अरसाचा वांचाई हत्ती ते वर्षते भारतमा भारतीय कारीगरेना हाथे अंधायेव एवं पहेली रीटमटोन्य हत्ती, आयारे एवं भक्तवत्ता प्रसंजे काम आपे छे.

७. कृष्णमां बिहारी(भांडवी तालुक)मां साविक्षनिक संस्था तरडीथी आंधनी तथा अंध दरडोना निवारण तथा सारवार अर्थे छांसिपटल याले छे. आरापर(भूज तालुक)मां तथा मस्क(मांडवी तालुक)मां क्षमनिवारण्य हेसिपटल-सेनियरियमो धांधा वर्षो धांधा सेवा आपे छे.

८० अ. भूजमां शेठ डासाभाई वालवंद दो फोलेन तथा श्री.जे.भी. इक्कर कॉमर्स फोलेन धांधा वर्षो धांधा स्थायेव छे अने विशेषमां सरकार तरडीथी पेकिटेनिक गया वर्स (१८८६)थी चालु थेव छे. भूजमां वीक्क तथु हाईस्कूल तथा शेठ डासाभाई वालवंद गवर्स हाईस्कूल वर्षो धांधा सेवा आपे छे.

८०. भूज उपरोक्त कुंला गांधीधामी मुख्य भाई अर-सर्विसतु विमान अडवाडियामां अमुख दिवसे भाई अमदावाद थर्नने जाय छे. ए भाई अरोड़ोम अंगार नक्क गणपादर गाम पासे आवेद छे.

९. अ. अरमां शेठ धरमसी वक्तव्यदास हाईस्कूल उपरोक्त नगरपालिका हाईस्कूल तथा श्रीमती कुमाराई गर्ल्स हाईस्कूल याले छे. वर्षो पहेलां अदीं शेठ नीकमण ऊवळदास ईंगलश रूप छत्ती. शेठ नीकमण ऊवळदास ज्ञन प्रेस कृष्णमां जूनी लिनिंग हेटरी छे तथा एक भाव ज्ञन प्रेस छे.

१०. मांडवीना जूनी गो.ते. हाईस्कूल उपरोक्त अन्य तथा हाईस्कूलो तथा एक आर्द्धस सायन्स अने डोमर्स फोलेन याले छे. आधिपुरामां तोलाशी योविद्येनिक उपरोक्त सरकारी ईंगलिदूप ट्रैनिंग रूप याले छे. डेरामा(भूज तालुक) लहोर संस्था तरडीथी छ-एस्ट्रियल ट्रैनिंग रूप याले छे. मुंद्रामा हाईस्कूल उपरोक्त ट्रैनिंग फोलेन पर्य याले छे.

११. कृष्णमां ई.स. १८२० थी १८५० दरम्यान विदेश साथे बहुगो वेपार-संघध धरावनार अंथायां वेपारमां मुख्य अने विष्यात वेपारी तरीके नामना धरावनार शेठ कल्याणशु धनक नामे शाश देशावर थर्न गया, अमेला डासाई(भांडवी)ना वतनी हता. एमेनी मुख्य पेठी मांडवीमां हती. कृष्णमां वीनां शेठेसामा शासाओ छत्ती.

१२. कृष्णना भक्तवत्ता संपूर्तो : (पुरुषाणी) वधारेः :


कृष्णना जूना हीवानो घोडा भक्तवत्ता दीवानो : (१) रतनक मेनक मोठ (१८४८-१८५८) तथा (२) वक्तव्यदास लाला मोठ (१८५५-६६), विशेषमां रायगढाहुर जगत्कृत ज्ञवत्ता मोठ कृष्णना भदान सुलद्दो अने विहान हता, जेहा धांधा वर्षो मुख्य वेस्टबर्मेना दीवान-पटे रहेव हता.

कृष्णी प्रजाईय येसिवहाना प्रभुओः :

(१) शेठ सूरज वक्तव्यदास, (२) शेठ बद्धभीदास तेससी, (३) जनाम याकुप लुगेन, (४) डो. निहारीलाल अंताशी, (५) श्री. महेन्द्रनीली, तथा (६) युवालाल हर अनुत्तवाल योगिनिया.

कृष्ण जिवला पंचायतना भ्रमुख तेभज कृष्णमां ई.स. १८२० ना अरसाथी रवदेशी तथा राजकीय प्रवृत्तिमां अब भाग लेनार अंगरना वतनी श्री किंत्रिप्री : अंताशी भ. गांधीज्ञना कृष्ण-प्रवास (१८२५) वर्षते एमीनी साथे रहेव हता.

"कृष्ण तेषा ज्य देशविदेश, ज्य ज्य पुण्य प्रदेश" (वेष्टक हृत 'कृतिना ज्ञेत' अंथमांथी)



# જ્યારે ગુજરાતની ધરતી સોનું પુફરો

સરદાર સરોવર ચોજના ગુજરાત માટે કામદેહની કેમ દૂંગણી  
સાબિત થવાની છે.

સરદાર સરોવર ચોજના અર્થાત् ૪૩૭ વર્ષનું આયુષ, પ્રતિદિન  
રૂ. ૪ કરોડની આવક, ૬ લાખ લોડને કાપમી રોજગાર, ૧૩૧ શહેરો  
અને ૪,૭૨૦ ગામદાંચેનાં ૨,૬૫,૦૦,૦૦૦ લોડની તૃપતાનિ,  
૨૫,૦૦,૦૦૦ લોડને સિંચાઈનો લાભ, ૧૮ લાખ હેક્ટર જમીનને સિંચાઈ,  
૪.૨૫ કરોડ વૃક્ષોનું વૃદ્ધાવન, ૫૦૦ કરોડ ચુનિટ વીજાઉતપાદન, ઉદ્ઘોગના  
વીજ-કાપનો અંત, મતસ્યોગધી રૂ. ૧૮૫ કરોડનો ઝાયદા, ફૂષ-ફૈન્ડ  
રૂ. ૬૦૦ કરોડનો લાભ, ૪૫ કાં જોડાનાં વૃક્ષ, આરોગ્ય સુધરણે,  
૨૪ આફ્ટરો અને પર્યાવરણ મધુવન કેનું બની જશે, નળ સરોવર બનને  
નયાંનું નજરાઓ, વૃદ્ધાવ, કાળિયાર અને વુખમલ રીછને અભયળુંન,  
સૌરાષ્ટ્ર બનને સુજલામ સુફ્લામ, રણ રોકાણો, પવિત્ર હિનારો પ્રવાસન-  
ધામ બનશે, દુઃકાળને ગુડ ભાગ, રાજ્યનો આર્થિક વિકાશ થશે, વિસ્થાપિતાને  
નયાંનુંન મળશે, ગુજરાત નંદનવન બનશે.

સરદાર સરોવર નર્મદા નિગમ, લિ.,

ફોન નં. ૧૨, પ્રથમ ભાગ,

સરદાર ભાગન,

ગાંધીનગર-૩૮૨૦૧૦

મુદ્રણ પ્રકાશન અને તરીકે : 'પથિક કાયલિય' માટે પ્રો. ડેશવરામ ઠ. શાસી, ઠ. મધુવન, એકિસાંખ્ય,  
અમદાવાદ-૩૮૦૦૦૧

તા. ૧૫-૧-૧૯૬૭

મુશ્યાસ્થાન : પ્રેરણી મુશ્યાસ્થાય, રૂસ્તમમણીનો ટાળ, મિરળપુર, અમદાવાદ-૩૮૦૦૦૧

પ્રિન્ટ : ઇન્ટરનેશનલ પ્રિન્ટિંગ વિઝેસ, શાલ્યપુર, માળિવાડાની પેણ સામે, અમદાવાદ-૩૮૦૦૦૧.